

યુસુકે ઝેરા

(ભાગ-૪)

- : પ્રકાશક : -

હાજી નાજી મેમોરીયલ ટ્રસ્ટ

માળી ટેકરા, આંબાચોક, ભાવનગર

ફોનનંબર : (૦૨૭૮) ૨૫૧૦૦૫૬ / ૨૪૨૩૭૪૬

... Kitab Downloaded from ...

www.hajinaji.com

● LIKE US ON FACEBOOK ●

www.facebook.com/HajiNajiTrust

નોંધ.....

- વધુ કિતાબો ડાઉનલોડ કરવા
માટે www.hajinaji.com પર
લોગ ઓન કરો.
- કિતાબમાં કોઈ ભૂલચૂક જણાય
તો પેજની વિગત અને
કિતાબનું નામ જાણ કરવા
વિનંતી.

hajinajitrust@yahoo.com

મિઝાનુલ હિકમત - ભાગ બીજો

અનુક્રમણિકા

ક્રમ	વિષય	પેજ.
૧	મારા જરીએ મારી એહલ અને શીઆ પરથી મુસીબતો દૂર થશે.	7
૨	વેપારમાં ઈંસાફના કારણે ઈ.મહદી (અ.સ.)ની મુલાકાત	8
૩	ઈમામે જમાના અલયહિલ્લસલામ માટે દુआ કરવાના ફાયદા.	15
૪	ખુમ્બણી અહેમીર્યત	17
૫	અદ્વાહના દોષ્ટ, દોષ્ટે ઈમામ અ.સ. 'હાલુ'	23

૭	ઇ.મહદી (અ.સ.) ની બારગાહમાં અરીજા	32
૮	“નમાજ”	35
૯	લકવાની બિમારીમાં શિક્ષા	38
૧૦	ઇમામે વક્ત દિલની વાતોને જણો છે.	40
૧૧	ક્રમાના અ.સ.ની દુઆથી પતિ પત્ની વચ્ચે સમાધાન થયું.	46
૧૨	એક તાલીબે ઇલમની ઇમામ (અ.સ.)થી મુલાકાત	51
૧૩	ઇમામ (અ.સ.)ના રોજાનાં ખાઈમને મુલાકાત	53

૧૩	મોહમ્મદ અને મુસલમાનોના બે સમૂહ	(સ.અ.વ.)	
૧૪	મહેનતનું ફળ		57
૧૫	દુઆની ઈચ્�ા		58
૧૬	પોતાનું કામ પોતે કરો.		66
૧૭	હજની મુસાફરીનો સાથી		71
૧૮	અલ્લાહ કોને દોસ્ત નથી રાખતો ?		73

૧૯	ઇ.સાજાદ (અ.સ.)ની નમ્રતા.	76
૨૦	અખલાકે રસૂલે અકરમ (સ.અ.પ)	79
૨૧	ગુરુસો નહીં કરતો!	83
૨૨	તે ઇસાઈ મુસલમાન થઈ ગયો.	87
૨૩	ફોઝેલનો બેઠમાન વિદ્યાર્થી	89
૨૪	નમાજે શાબ	91

ਬਿਸ਼ਮਿਲਤਾਹਿਰ ਰਹਮਾ ਨਿਰ ਰਹੀਮ

ਚੁਲ੍ਹੇ ਅਹਰਾ ਭਾਗ - ੪

ਪ੍ਰਕਣਣ - ੧ ਮਾਰਾ ਝਰੀਐ ਮਾਰੀ ਏਹਲ ਅਨੇ
ਸ਼ੀਆ ਪਰਥੀ ਮੁਕਾਬਲਾ ਦੂਰ ਥਥੇ.

ਈਖਾਹੀਮ ਜੀਨ ਮੋਹਮਦ ਅਲਵੀਥੀ ਰਿਵਾਯਤ
ਛੇ ਕੇ ਮਨੇ ਤਰੀਕ ਅਬੁ ਨਰੰਕੈ ਬਿਨਾਂ ਫਰਮਾਵਿੰਦੁ ਕੇ ਹੁੰ
ਈ.ਅਮਾਨਾ (ਅ.ਸ.)ਨੀ ਖਿਦਮਤਮਾਂ ਹਾਜੀਰ ਥਥੇ।
ਆਪੇ ਮਨੇ ਲਾਲ ਚੰਦਨ ਆਪਿੰਦੁ, ਅਨੇ ਫਰਮਾਵਿੰਦੁ ਕੇ ਸ਼ੁੰ
ਤਮੇ ਮਨੇ ਓਗਖੋ ਛੋ? ਮੇ ਕਹਿੰਦੁ, 'ਹਾ' ਆਪੇ
ਫਰਮਾਵਿੰਦੁ "ਹੁੰ ਕੋਣ ਛੁੰ ?" ਮੇ ਜਵਾਬ ਆਪਿੰਦੋ,

"ਆਪ ਮਾਰਾ ਸਰਦਾਰ ਅਨੇ ਸਰਦਾਰਨਾਂ ਫਰਾਂਦ
ਛੋ" ਆਪੇ ਕਹਿੰਦੁ "ਆ ਮਾਰਾ ਪ੍ਰਕਣਨੋ ਜਵਾਬ
ਨਥੀ" ਮੇ ਕਹਿੰਦੁ "ਹੁ ਆਪਨਾ ਪਰ ਕੁਰਬਾਨ, ਆਪ
ਜੇ ਬਤਾਵੋ" ਆਪੇ ਫਰਮਾਵਿੰਦੁ "ਹੁੰ ਖਾਤੇਮੁਲ
ਅਵਸੀਖਾ ਛੁੰ, ਮਾਰਾ ਝਰੀਐ ਮਾਰੀ ਏਹਲ ਅਨੇ

મારા શીઆ પરથી મુખ્યિબતો દૂર થશે.
(કમાલુદ્ધીન વ તમામુન નેઅમા પેજ.૪૨૭)

પ્રકરણ – ૨ વેપારમાં ઈંસાફના કારણે ઈ.મહદી (અ.સ.)ની મુલાકાત

એક માણસને હ.ડ જમાના અ.સ.ની મુલાકાત અને જિયારતની મોટી તમજી હતી. દરેક સમયે તેના મનમાં ફૂકત આ એક જ તમજી રહેતી હતી. મુલાકાતથી વંચિત રહેવાનાં કારણે તે ખૂબ જ ગમગીન રહેતો.

તે ઈંસાને મુલાકાત માટે ખૂબ જ દુઆ કરી, ખૂબ જ ઈબાદત કરી, જે અમલ થઈ શકતો હતો. તે અંજમ આપ્યો, નજ્ફે અશારફનાં આલીમોમાં આ વાત મશાહુર છે, કે અગર કોઈ શખ્સ હજરત ઈમામે જમાના અ.સ.ની મુલાકાત કરવા ચાહતો હોય તો તેને જોઈએ કે તે ૪૦ શબે બુધ મગરીબ ઈશાની નમાઝ મરજીએ સહલામાં અદા કરે. ઈંશાઅદ્ધાર ઈમામ અલયહિસ્સલામની જિયારત નસીબ થશે.

આ વ્યક્તિએ પણ તેના ઉપર અમલ કર્યો કે જેથી તેની તમદ્દી પુરી થાય. ત્યાર પછી તેણે બીજી ઈભો, ઈલ્મે અઅદાદ વગેરેનો સહારો લીધો. તેમાં કાબેલીયત મેળવી દરેક પ્રકારની કોશીષ કરી. પરંતુ તમદ્દી પૂરી ન થઈ. તેણે ચાલીસ ચાલીસ દિવસનાં કેટલાય અમલ કર્યા, તો પણ તેની જિયારતે ઈમામ અ.ની હાજર પુરી ન થઈ. તેમાં એવા અમલ પણ કર્યા જેમાં આખી રાત જગતું પડતું. આ અમલો (કાર્યો ઈબાદત) એ તેની ઝણને પાડ કરી દીધી, અને તેને ખાસ નુરાનીયત પ્રાપ્ત થઈ.

એક વખત કોઈએ તેને કહ્યું, અગર તમે ઈમામે જમાના અલયહિસ્સલામની જિયારતની ખુશાનસીબી હાંસિલ કરવા ઈચ્છતા હો અને તેમની મુલાકાત કરવા ચાહતા હો તો ફ્લાણા શહેરમાં ચાલ્યા જવ. તે શહેર જે કે ઘણું દૂર હતું, અને મુસાજરી પણ સરળ ન હતી. પરંતુ ઈમામથી મુલાકાતની તમદ્દી તેને ત્યાં લઈ આવી.

તે શહેરમાં આવીને તેને ૩૭ અથવા ૩૮ દિવસ થઈ ગયા હતા, પરંતુ તેની હાજત પુરી થઈ ન હતી. એક વખત તેને એક સંદેશો મળ્યો. અગર તમે ઈમામે જમાના અલયહીસ્સલામથી મુલાકાત કરવા ચાહતા હો, તો આ સમયે ઈમામે જમાના અ.સ. બજારમાં વૃદ્ધ તાળા વેચનારની દુકાને તશરીફ લાવ્યા છે. હમણા જ તુરંતજ જવ, તમારી હાજત પુરી થશે અને વર્ષોની તમણા પુરી થશે.

આ માણસ તુરંતજ ઉભો થયો, અને બતાવેલા રહ્યા પર ચાલવા લાગ્યો. વૃદ્ધ તાળા વેચનારની દુકાને પહોંચ્યો. જોયું કે ઈમામે જમાના અલયહીસ્સલામ ત્યાં મૌજૂદ છે, અને વૃદ્ધ શાખસ સાથે ખૂબ જ મોહંબતથી વાતો કરી રહ્યા છે. તેણે ઈમામે અર્સ અલયહીસ્સલામની ખિદમતમાં સલામ કરી. ઈમામ અલયહીસ્સલામે જવાબ આપ્યો અને ચૂપ રહેવા ઈશારો કર્યો.

તે સમયે દુકાને એક વૃદ્ધ ઔરત આવી હતી. જે ખૂબજ કમાડોર હતી, તેની કમર ઝડી ગઇ હતી.

ଛାଥମାଁ ଲାକଡ଼ି ହତି. ଛାଥ ଧୂଳ ରହ୍ୟା ହତାଂ ପଗ ଡାଂପତା ହତା. ଆ ଛାଲତମାଁ ତେଣେ ଏକ ତାଙ୍ଗ ପୃଷ୍ଠ ଦୁକାନଦାରନେ ଆପ୍ଯୁଂ ଅନେ କହ୍ୟୁଂ, “ଶୁ ତମେ ଆ ତାଣାନେ ତ୍ରୈ ଝପିଯାମାଁ ଖରୀଦଶୋ, କାରଣକେ ଆ ସମୟେ ମନେ ତ୍ରୈ ଝପିଯାଣୀ ଖୁବଜ୍ଞ ଜନ୍ମରତ ଛେ.” ତେ ପୃଷ୍ଠ ଦୁକାନଦାରେ ତାଙ୍ଗ ଛାଥମାଁ ଲିଧୁ ଜେଯୁଂ ତୋ ତାଣମାଁ କୋଈ ଖରାବୀ ନ ହତି. ତାଙ୍ଗ ବିଲ୍କୁଳ ସାଙ୍ଗ ହତୁ. ତେଣେ କହ୍ୟୁଂ “ଅୟ ବହେନ! ଆ ତାଣାନୀ କିମତ ଦସ ଝପିଯା ଛେ ଅଗର ତମେ ତେଣୀ ଚାଵିନାଂ ଜେ ଝପିଯା ଆପଶୋ, ତୋ ତାଣାନୀ କିମତ ଦସ ଝପିଯା ଆଵଶୋ.” ତେ ପୃଷ୍ଠ କ୍ଷୀଅେ କହ୍ୟୁଂ “ମନେ ଆ ତାଣାନୀ ଜନ୍ମରତ ନଥି ମନେ ତୋ ଆ ସମୟେ ଫଳତ ତ୍ରୈ ଝପିଯାଣୀ ଜନ୍ମରତ ଛେ. ତମେ ତ୍ରୈ ଝପିଯା ଆପି ଦୟୋ ଅନେ ତାଙ୍ଗ ଲଈ ଲୋ”.

ତେ ପୃଷ୍ଠ ଦୁକାନଦାରେ କହ୍ୟୁଂ, “ବହେନ! ହୁ ପଣ ମୁଖଲମାନ ଛୁ ଅନେ ତମେ ପଣ ମୁଖଲମାନ ଛୋ. ହୁ ଏକ ମୁଖଲମାନଙ୍କେ ମାଲ ସରସାମାଁ ଶା ମାଟେ ଖରୀଦୁଂ? ଅନେ କୋଈନା ଛକନେ ଶା ମାଟେ ବରବାଦ କଢ଼ି? ଅତ୍ୟାରେ

આ તાળાની કિમત ૮ રૂપિયા છે. અગર નજો મેળવવા ચાહું તો હું આ તાળાને ૭ રૂપિયામાં ખરીદીશ, કારણે આનાથી વધારે નજો મેળવવો ઈંસાફની વિઝદ્ધ છે. અગર તમે આ તાળુ વેચવા ચાહો તો હું ૭ રૂપિયામાં ખરીદીશ, અને એક રૂપિયો નજો લઈ ૮ રૂપિયામાં વેચીશ. હું ફરીવાર કહું છું, આ તાળાની કિમત ૮ રૂપિયા છે અને ૭ રૂપિયામાં ખરીદીશ અને ૧ રૂપિયો નજો મેળવીને ૮ રૂપિયામાં વેચીશ.” આ વૃદ્ધ જીને દુકાનદારની વાત પર યકીન આપતું ન હતું. તે નાખુશ થઈને બોલી “હું કેટલી વારથી આ બજારમાં ફરું છું. એક એક દુકાનદારને વિનંતી કરી, પરંતુ એક પણ વેપારી ત્રણ રૂપિયામાં તાળુ ખરીદવા તૈયાર ન હતો. મારે અત્યારે ત્રણ રૂપિયાની જરૂરત છે, અને બજારમાં ત્રણ રૂપિયામાં તાળુ ખરીદવા કોઈ તૈયાર નથી.” તે વૃદ્ધ દુકાનદારે ૭ રૂપિયા તે વૃદ્ધ જીને આપ્યા અને તાળુ ખરીદી લીધું.

આ સમયે ઈમામ અ.સ. તે ઈન્દ્રાન ને કહે છે. “અય મારા દોષ્ટ, તે આ પ્રસંગને જોયો. અગર તમે લોકો આ રીતે રહો, આ રીતે ઈન્દ્રાન થી વર્તો તો હું ખુદ તમારી પાસે આવીશ, તમારે આટલી મુશ્કેલી અને મહેનત કરવાની જરૂર નથી.

“તમે અમલ (નેક કાર્યો) કરો. મુસ્લિમાન બનો કે જેથી અમે તમારી મદદ કરીએ, મે આ શહેરમાં આ વૃદ્ધ શાખસને પસંદ કરી લીધો છે. કારણે આ માણસ મજુબી (દીનદાર) છે. ખુદાને ઓળખે છે તે તેમનું ઈમતોહાન જોયું, આ વૃદ્ધ સ્ત્રી બધી દુકાને ગઈ તેને જરૂરતમંડ જોઈને દરેક તેના માલને ઓછી કિમતમાં ખરીદવા ચાહતા હતા. કોઈ તેના (તાળાના) ૩ ઢાપિયા દેવા પણ તૈયાર ન હતું, પરંતુ આ વૃદ્ધ દુકાનદારે તે તાળાને ૭ ઢાપિયામાં ખરીદયું. આજ કારણ છે કે હું તેની મુલાકાતે તેના ખબર અંતર પૂછવા દર અઠવાડીયે આપું છું.”

(કીમીયા એ મોહંજબત, પેજ-૪૧ થી ૪૩)

તારણો: આ વાકેઆમાંથી આપણને સબક
મળે છે કે

- (૧) અગર આપણી જીંદગીમાં, આપણા ધંધામાં,
આપણા પેપારમાં ઈમાનદારીથી કામ લઈએ, તો
ઈમામે ઝમાના અલયહિસ્સ્લામની
ઈનાય તો આપણી સાથે હશે.
- (૨) અને એક કામ ખુદાની ખુશનુંદી માટે કરીએ.
- (૩) કોઈની મજબુરીનો ખોટે ફાયદો ન
ઉપાડીએ.
- (૪) વસ્તુને તેની યોગ્ય કિમતમાં ખરીદીએ.
- (૫) એક મુનાસીબ માપથી વધારે નફો હાંસિલ
ન કરીએ.

પ્રકરણ – ૩ ઈમામે ઝમાના અલયહિસ્સલામ માટે દુઆ કરવાના ફાયદા.

હજરત આયતુલ્લાહ સૈયદ મોહમ્મદતકી મુસવી ઈઝફુની અલરહીર રહેમા એ પોતાની ડિતાબ “મીડયાલુલ મકારીમ”માં ઈ.ઝમાના અ.સ. માટે દુઆ કરવાના ૯૦ ફાયદા લખ્યા છે. ૧૪ માસુમીનાની મુખારક સંખ્યા ૧૪ પ્રમાણે ૧૪ ફાયદા અહીં લખીએ છીએ.

ઈમામે ઝમાના અલયહિસ્સલામ માટે દુઆ કરવાથી

૧. નેઅમતોમાં વધારો થાય છે.
૨. આખરી ઝમાનાનાં ફ્રિનાથી નજીત મળે છે.
૩. ઈમામે ઝમાના અલયહિસ્સલામ તેના માટે દુઆ કરે છે.

૪. કયામતમાં પૈગમબરે અકર્મ (સ.અ.વ) અને અહેલેબૈત(અ.મુ.સ) ની શફાઆત નર્સીબ થશે.

૫. આપણી ટુઆઓ કબુલ થાય છે.

૬. અજે રીસાલત અદા થાય છે. ૭. આયુષ્યમાં વધારો થાય છે.

૮. કબ્ર અને કયામતની મુશ્કેલીઓથી નજીત મળે છે.

૯૦. ફરીશ્તાઓ તેના હકમાં ટુઆ કરે છે.

૧૧. કયામતમાં ૪.ઝરા સ.અ. ની શફાઆત નર્સીબ થશે.

૧૨. કયામતનાં દિવસે તેની ખિદમતમાં જેહતરીન તોહફાઓ પેશ કરવામાં આવશે.

૧૩. શાહીદનો સવાબ મળશે.

૧૪. તેની બુરાઈઓને નેકીઓમાં ફેરવી દેવામાં આવશે.

(મીકયાલુલ મકારીમ ભાગ-૧)

યા અષ્ટાહુ! તને પંજેતને પાડનો વાસ્તો ચુચુછે
જહેરા ઈ.જમાના ઈ.મહદીઅ.નાં જુહુરમાં જલ્દી
કર....અને તેમના ગુલામોના ગુલામોમાં અમારો
શુમાર કર (ઈ.આમીન)

પ્રકરણ – ૪ ખુમ્સની અહેમીયત

હસાન મુશાતરીક કહે છે કે એક દિવસ અબુદુલ્લા
બિન અહેમદ નાસીરીઝુદ્દોલાની બેઠકમાં બેઠો હતો.
આ બેઠકમાં ઈ.જમાના અ.ની ગયબતનો ફિક થઇ
રહ્યો હતો. મે આ અકીદાની મજાક ઉડાવી.આ
સમયે મારા કાડા હુસૈન આ બેઠકમાં દાખલ થયા,
અને તેમણે મને સંબોધીને કહ્યું, “અય બેટા!
મારો અકીદો પણ તારા અકીદા જેવો જ હતો પણ...”

એક વખતની વાત છે, કે મને કુમણી હુક્મત
મળી, કારણકે કુમવાસીયો બગાવત પર ઉત્તરી
પડ્યા હતા અને જે પણ હાડીમ ત્યાં જતો તો કુમના
લોકો તેને કર્લ કરી દેતા, અને સુલતાનનાં
હુક્મથી મારે ત્યાં જવાનું થયું. હું એક લશ્કર લઈને
મિઝાનુલ હિક્મત - 17

કુમ તરફ રવાના થયો અને અમારો પડાવ જરૂર નામની જગતાએ હતો. ત્યારે હું શિકાર કરવા નીકળ્યો, અને એક પ્રાણી પાઇળ હું શિકાર માટે પડ્યો અને હું જંગલમાં ઘણો જ દૂર નીકળી ગયો, અને એક નહેર પાસે પહોંચી ગયો, અને હું તેના કિનારે કિનારે ચાલતો રહ્યો અને જેમ આગળ જતો તેમ નહેરની પહોળાઈ વધતી જતી હતી.

આજ અરસામાં મેં એક ઘોડેસવારને જોયા જેઓ લાલ કલરનાં ઘોડા ઉપર સવાર હતા, અને માથા લીલો અમામો પહેર્યો હતો. ફક્ત તેમની આંખો જ દેખાતી હતી. તેમણે પગમાં લાલ કલરનાં મોજ પહેર્યા હતા. તે ઘોડેસવારે કહ્યું, “અય હુસૈન (તેણે મને અમીર ન કહ્યો, કે ન મને કુઝીચીયતથી બોલાત્યો પરંતુ નામ લઈને બોલાત્યો. શા માટે તમે ભૂલ કરો છો? અને મારી ઈમામતને હલકી સમજો છો? અને તમારા માલમાંથી ખુમ્બ કાઢીને મારા અસહાબ અને નાઅબ સુધી શા માટે નથી પહોંચાડતા? હુસૈન

આગળ કહે છે, કે હું એક બાવડાર બહાદુર ઈંજીનિયર હતો અને કોઈના થી પણ ડરતો નહિ, પરંતુ તે ઘોડેસવારનાં શાઢોથી ધૂજવા લાગ્યો અને ભયભીત થઈ ગયો અને મે કહ્યું “અય મારા સૈયદો સરદાર! તમે જે ફરમાત્યું, તે મૂજબ અમલ કરીશ.”

પછી તે ઘોડેસવારે (કે જેઓ ઈ.જમાના અ.સ. હતા) કહ્યું, તું જે જગ્યાએ (કુમ) જવાનો ઈરાદો રાખે છે, ત્યાં જઈને તુ આસાનીથી સંઘર્ષ વગર, કલે આમ વગર તું તે શહેર (કુમ)માં દાખલ થઈશ અને તું જે કમાણી કર તેમાંથી ખુમ્મ કાઠજે અને તેના છકદાર સુધી પહોંચાડજે. મેં કહ્યું “હા” હું તે પ્રમાણે જ કરીશ. પછી તેમણે કહ્યું જવ અને પોતે ઘોડાની લગામ ખેંચીને ચાલ્યા ગયા. મારી નજરોથી ગાઅબ થઈ ગયા. મને ખબર ન પડી કે તેઓ કઇ તરફ ગયા મે ડાબી જમણી બાજુ જોયું અને પાછો ચાલ્યો આત્યો. અને પછી હું આ આખો બનાવ બૂલી ગયો.

કુમ પહોંચવાની તૈયારી હતી, ત્યારે મારો ખ્યાલ હતો કે કુમ વાસીઓ સાથે ચુદ્ધ કરવું પડશે પરંતુ મને નવાઈ લાગી કે જ્યારે મે જોયું કે કુમ વાસીઓ સામેથી અમને કુમની બહાર મળવા આવ્યાં, અને કહ્યું જે કોઈ હાડીમ અમારા મજહબના અકીદાથી વિરુદ્ધ મજહબનો હાડીમ આવતો તો અમે તેને કટલ કરી દેતા, પરંતુ તમે તો અમારામાંથી જ છો, અને અમારી તરફ આવ્યાં છો. તેથી તમારી અને અમારી વર્ષયે કોઈ પણ જતનો વિરોધ નથી. માટે તમે ખુશીથી શહેરમાં દાખલ થાવ અને જે રીતે ચાહો તે રીતે શહેરની વ્યવસ્થા સંભાળો.

હું શહેરમાં દાખલ થયો અને શાસન વ્યવસ્થા સંભાળી લીધી. પછી હું એક લાંબો સમય કુમનાં અમીર તરીકે રહ્યો અને પુષ્ટ માલો દૌલતની કમાણી કરી. આ બાજુ બાદશાહનાં માણસોએ મારા વિરુદ્ધ બાદશાહની કાનબંબોરણી કરી અને બાદશાહે મને કુમનાં

હાકીમનાં પદ પરથી દૂર કરી દીધો. હું પાછો બગાડાદ ચાલ્યો આત્યો અને સીધો બાદશાહને મળીને મારા ઘરે પાછો ફર્યો.

મારા ઘરમાં લોકો મને મળવા માટે આવવા લાગ્યા, અને મારો રૂમ મુલાકાતીઓથી ભરેલો હતો. એ જ અરસામાં જ.મોહમ્મદ બીજી ઉસ્માન (અ.ર.) (જેઓ ગયબતે સુગરામા ઈ.જમાના અ.નાં બીજ નાઓબ હતા.) આત્યાં. બધા લોકોને દૂર કરીને મારી પાસે આત્યા અને મારી જગ્યાની બાજુમાં મારી પીઠ ને ટેકો દઈને બેસી ગયા . જગ્યારે બધા ચાલ્યા ગયા અને હું અને જ.મોહમ્મદ બીજી ઉસ્માન બંને રૂમમાં એકલા રહ્યાં ત્યારે તેઓઓ મારી તરફ જોઈને કહ્યું મારી અને તમારી વચ્ચે એક રાજ છે. સાંભળી લ્યો. મે કહ્યું “બયાન કરો” મોહમ્મદ બીજી ઉસ્માને કહ્યું “લાલ કલરનાં ધોડાના સવારે કહેડાયું છે કે અમે અમારો વાયદો પૂરો કર્યો છે. આ સાંભળતા, મને આખો બનાવ

યાદ આવી ગયો, અને મારા શરીરમાંથી ધૂજારી
પચાર થઇ ગઈ.

મે કહ્યું મે સાંભળી લીધુ, હું તમારી ઈતાઅત
કરીશ અને હું તમારો દિલો જનથી અહેસાનમંદ
છું. પછીહું ઉભો થયો અને તેઓનો હાથ પડડયો
અને અંદરનાં રૂમમાં લઈ ગયો. જ્યાં મે મારો
ખજનો (જે માલ કમાએલો હતો) રાખ્યો હતો, ત્યાં
લઈ ગયો અને તેઓને મે પૂરા માલનું ખુમ્સ અદા
કરી દીધુ આમાંથી અમૂક માલ હું ભૂલી ગયો હતો,
તો જ. મોહમ્મદબીન ઉસ્માને મને તે પણ યાદ
દેવડાયું અને તેનું પણ ખુમ્સ અદા કરાયું અને
આ બનાવ પછી મે કયારેય પણ સાહેબુલ અમ્
(ઇ. ઝમાના અ.) નાં બાવામાં શક નથી કર્યો.

હસન મુશતરીક કહે છે કે જ્યાર થી મે આ
બનાવ મારા કાડાના મોં થી સાંભળ્યો ત્યારથી
મારો ઇ. ઝમાના અ. નાં બાવામાં અડીદો સહીછ થઇ
ગયો અને મે દિલથી આપ અ. સ. ને કબુલ કરી
લીધા.

(હક્કુલ યકીન, ભાગ-૨ પેજ:-૩૪૫, ૩૪૬)

પ્રકરણ – ૫ અધ્યાત્મના દોષ્ટ,

દોષ્ટે ઈમામ અ.સ. 'ઈલુ'

હું જમાઝ પઠવા માટે મર્જીદ તરફ જઈ રહ્યો હતો. મર્જીદ થોડા અંતરે જ હતી ત્યાં મે ઓક જનાજાને જોયો. આ જનાજામાં સમાજનાં થોડી સંખ્યામાં ગરીબ લોકો શામીલ હતાં. તે જોતા એમ લાગતું હતું કે આ જનાજો કોઈ ગરીબ માણસનો છે. પરંતુ મને ત્યારે નવાઈ લાગી કે જ્યારે મે જોયું કે જનાજામાં શામીલ લોકોની વચ્ચમાં બજારનાં મશાહુર, બાવડાર વેપારી જનાજાની બિલકુલ નજીદીક ચાલી રહ્યા હતા. આ વેપારી નુરાની અહેરાવાળા અને પાડીઝા સિફ્ફતો ધરાવતા હતા, અને દરેક લોકો તેમને પસંદ કરતા હતા. આ મોઅમીન વેપારી એટલા ગમગીન હતા, કે જણે તેમના કોઈ સગાનું મૃત્યુ થયું હોય. તેમની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા.

મને ખૂબ જ નવાઈ લાગી કે આખરે વાત શું છે ? જો આ મર્યાત કોઈ નજીદીનાં વેપારીના સંબંધીનું હોય, તો એલાન શા માટે નહીં કર્યું હોય ? અને મર્યાત કોઈ ગરીબ માણસનું હોય તો તેમના જનાજામાં આ વેપારીમાં ગમમાં શા માટે રડી રહ્યાં છે? હું આ વિચારી રહ્યો હતો. તે અરસામાં તેમની નજર મારા ઉપર પડી, અને મને નજીદ બોલાત્યો, અને કહ્યું કે શું તમે એક અદ્ભુતાદનાં દોષ્ટનાં જનાજામાં શરીર નહીં થાવ ? તેમણે એવા દર્દનાક અંદાજમાં કહ્યું કે હું એકદમ જનાજામાં શરીર થઇ ગયો. જનાજામાં આખા રક્તામાં તે વેપારી રડતા રહ્યાં, ત્યાં સુધી કે મર્યાત ગુરુસલખાના સુધી પહોંચ્યું.

હું ખૂબ થાડી ગયો, અને એક જગ્યાએ જેસી ગયો તે અરસામાં તે વેપારી મારી પાસે આત્યાં અને બોલ્યાં, “તમોએ ન પૂછ્યું કે આ મર્યાત કોનું છે? ” મે તુર્ણત જ પૂછ્યું કે આ મર્યાત કોનું છે? અને તમે મરુઠુમને કેટલા સમયથી ઓળખો છો?

તે વેપારીએ જવાબ આપ્યો કે આ એક અજુબ નવાઈ ભરી ઘટના છે. અજુબ ખૂબજ અજુબ મારી અને તેમની ઓળખાણ આ ઘટના સાથે સંબંધિત છે .હું જ્યારે આ બનાવને ચાદ કરું છું તો મારી રૂહમાં તાજગી પૈદા થઈ જાય છે. અને મારું ચડીન મજબૂત થઈ જાય છે.

વેપારી કહે છે, હું આ વર્ષે ૪૫ અદા કરવા ગયો હતો. મારી અને આ બુર્જુર્ગ શાખસની ઓળખાણ પણ તે સફરમાં ૪ થઈ. મકડા સુધી તો હું તેમને એક મામુલી ચોડીદાર, હેસીયત વગરનો સામાન્ય ગરીબ માણસ સમજતો હતો. બન્યું એમ કે અમારો કાફલો ઈરફાનથી હજની નિરયતથી મકડા તરફ રવાના થયો. અહીં સુધી કે અમે ઈરાડ પણોચ્યા ત્યાંથી કરબલા તરફ ઈ.હુસૈન અ.સ. ની જિયારત કરવાનાં ઈરાદાથી આગળ વઢ્યાં અમે કરબલાથી દૂર હતા. એક જગ્યાએ અમે અમારો પડાવ નાખ્યો.

બન્યું એપું કે આ જગ્યાએથી મારો તમામ માલ સામાન અને પૈસાની ચોરી થઈ ગઈ. મારી

પાસે મારી જરૂરત પૂરી કરવા માટે કાંઈ ન રહ્યું. એટલે સુધી કે મારા શરીર પર કપડા સિવાય કશું ન રહ્યું. ચારે બાજુ તપાસ કરી પણ કાંઈ પરિણામ ન આવ્યું. જેમતેમ મુશ્કેલીથી હું કરબલા પહોંચ્યો, અને કરબલામાં તો કોઈ માર્ગ સંબંધી કે ઓળખીતું પણ ન હતું કે જેથી હું તેમની પાસેથી કર્ઝ લઈ શકું.

હું બિલકુલ નિરાશ થઈ ગયો કે હવે હું હજ કરવા નહીં જઈ શકું, અને હજ મારા નસીબમાં નથી. અને આ જ છાલતમાં હું નજ્ફ તરજુ રવાના થયો. ત્યાંથી સીધો કુફ્ફાના રસ્તે ચાલવા લાગ્યો. હું થાકીને હારીને, નિરાશા ઉદાસીન સ્થિતિમાં એક જગ્યાએ બેસી ગયો. ચારે તરજુ અંધારુ હતું ન કોઈ દોષ્ટ હતો ન મદદગાર.

મેં આજુ બાજુ જોયું ત્યાં અચાનક મારી સામે પ્રકાશ (નુર) દેખાયું જાણો કે નુરનો વરસાદ વરસી રહ્યો હતો. એક અરબ કે જેમની પેશાની પહોળી હતી, અને ચહેરો એટલો બધો નુરાની હતો કે

પૂનમનો ચાંદ પણ શરમાય જય. તેઓ મારી સામે ઉભા હતા. (તેઓ ઈ.જમાના ઈ.મહિની અ.સ. હતા).

તેઓ મારા નજીદ આવ્યાં અને કહ્યું, “અય વેપારી તુ શા માટે પરેશાં છો શું થયું?” મેં કહ્યું, હુ મુસાફર છું અને ખુબ જ થાડી ગયો છું તેઓ ફરી પૂછ્યું “તારી પરેશાંનીનું બીજુ કારણ હોય તો બતાવ.” મેં મારા પર જે વિત્ત્યું તે બયાન કર્યું અને મારો માલ સામાન ઓરાઈ ગયો છે, તેની ફરિયાદ પણ કરી.આપ (અ.સ.) અવાજ કર્યો : હાલુ.

આ સાંભળીને હું ચોકી ગયો એ માટે કે હાલુ નામના એક ગરીબ માણસની અવર જવર તો મારા ઘરની સામેજ રહેતી અને હું તો હાલુ ને ઓળખતો પણ હતો.

એજ સમયમાં મારી સામે હાલુ આવીને ઉભો રહ્યો અને હું તાઅજજુબથી તેને જોઈ રહ્યો હતો, કે “આ માણસ ને તો હું સારી રીતે ઓળખું છું. આપ (અ.સ.) એ કહ્યુઃ હાલુ આ માણસની

માલ-મતા ચોરી થઈ ગઈ છે. તે મેળવીને આને આપી દો' એટલુ કહીને આપ (અ.સ.) ગાયબ થઈ ગયા. હજુ હું નવાઈમાંથી બહાર નીકળું ત્યાં તો હાલુ મારો માલ સામાન અને પેટી લઈને હાજર થઈ ગયા અને મને કહ્યુઃ આ તમારો સામાન પેટી ખોલીને જોય લો તમારો સામાન તથા રકમ સલામત છે કે નહીં? મે પેટી ખોલીને જોયુ તો મારો બધો સામાન તથા રકમ સલામત હતી. હાલુ એ મને આગળ કહ્યુ કે તમે આ સામાન તથા પેટી કોઈને આપી દો અને હું જે જગ્યા બતાવું ત્યા આવીને મને મળો એટલુ કહીને મને એક ખાસ જગ્યા બતાવી જગ્યા અમારે મળવાનું હતું. મે હાલુના કહેવા પ્રમાણે અમલ કર્યો અને નકડી કરેલી જગ્યાએ હું પહોંચી ગયો જગ્યા હાલુ મારી રાહ જોઈ રહ્યા હતા.

મને જોઈને હાલુ એ કહ્યુઃ મારી પાછળ પાછળ આવો અને આજુ બાજુ જોતા નહીં. હું તે પ્રમાણે ચાલવા લાગ્યો હજુ તો અમે થોડા ડગાલા

ભર્યા હતા ત્યાં તો અમો મકડાના પાછે સુધી પહોંચી ગયા. હાલુ એ મને કહ્યુઃ જ્યારે તમો તમારા સાથીદારોને મળો તો આ વાત કોઈને નહીં બલ્કે એમ કહેજો કે એક માણસે મને નજીદીના રહ્સ્તોથી અહીં સુધી પહોંચવામાં મદદ કરી. અને પછી હાલુ એ મને એક જગ્યા દેખાડેલી અને મને કહ્યુ કે તમો હજના અરડાન પૂરા કરી અહીં આ સમયે અને આ દિવસે મળજો.

આટલુ કહી હાલુ ખુદા હાફીઝ કહી રવાના થઈ ગયા. પછી મને મારા સાથીઓ મળ્યા. અમો એ હજ અદા કરી. પછી હું હાલુ એ દેખાડેલી જગ્યા એ અને કહેલા સમયે તે જગ્યાએ હાજર થઈ ગયો. થોડીવારમાં હાલુ પણ ત્યાં આવી ગયા. અને જ્યાંથી નીકળ્યા હતા. ત્યાં મને પાછો પહોંચાડી દીધો. રહ્સ્તામાં મે કોશીશ કરી કે હું હાલુની આ બલંદી અને મકામ વિષે કંઈ પુછું પણ તેની અક્રમત અને બુઝુગી આગળ મારી જબ ઉપડતી ન હતી. પરંતુ છુટા પડતી વખતે હાલુ એ મને એક

સવાલ કર્યો કે શું મારી દોષતી અને મોહબ્બતનો તમારા પર કોઈ હક્ક છે? મે કહ્યુઃ હા હા બેશક તમારો મારીપર બુલી ન શકાય તેવો હક્ક છે. હાલું એ કહ્યુઃ વખત આવે આ હક્કને અદા કરવાનો હું તમોને મોડો આપીશ. પછી હું ત્યાંથી કરબલા અને જીજ મુક્કદૂષ જિયારતગાહોની જિયારત કરી, દૂષણ પરત ચાલ્યો આત્યો.

જીજ દીવસે મારા સંબધીઓ અને મિત્રો મને મળવા આવી રહ્યા હતાં. તે સમયે હાલું પણ ચોડીદારના વેષમાં મને મળવા આત્યા. હું હાલુને જોઈને મારી જગ્યાઓથી તેઓના અહેતરામ માટે ઉભો થવા જતો હતો. ત્યાં હાલું એ મને ઈશારાથી તેમ કરવાની ના પાડી અને ઈશારાથી તે પણ સમજવી દીધું કે આખી વાતને રાજ જ રાખવાની છે. તેને જહેર કરવાની નથી. પછી ઉભા થઈ ને ચાલવા લાગ્યા. જતી વખતે તે મારી પાસે આત્યા અને મને કહ્યું જે દીવસ પછી મારું મુત્ય થઈ જશે. મારા ઘરના ઓરડામાં એક પેટી છે. જેમા મારું

કફળ છે. તે મને પહેરાવજો અને દીર્ઘમ મારી તદ્દ્દીન તથા તકફીન પાછળ ખર્ચ કરજો.

તેના કહેવા પ્રમાણે બે દીવસ પછી તેઓ મૃત્યુ પામ્યા. હુ હાલુના ઘરે ગયો તથા જે ચાર મજૂદુરો તથા ઓડીદારો ભેગા થયેલા હતા. મે હાલુના કહેવા પ્રમાણે તેના ઘરની અંદર રાખેલી પેટી ખોલી તો તેમાં કફળ અને આઠ દીર્ઘમ મૌજુદ હતા. આ મર્યાદ આજ બુજુર્ગ વાર (હાલુ)ની છે. આ અદ્ધારના દોસ્તની મર્યાદ ગુરુસ ખાનામાં રાખેલી છે. હવે તમો જ બતાવો કે શા માટે હુ આપા અદ્ધારના દોસ્તના ગમમાં ન રડું અને શા માટે મને તેના ઈન્ટોકાલથી સદમો ન પહોંચે.

(યીમામે વક્તવી ચોખટપે પેજ-પથી૧૧)

(નોંધ:- હાલુનો મતલબ સીધો, સાદો, શાંત અને સારા અકીદાવાળો થાય છે. તેથી સીધા, સાદા, શાંત લોકો ને હાલુ કહે છે.)

પ્રકરણ - ક ઈ.મહેદી (અ.સ.) ની

બારગાહમાં અરીજા

મરહુમ મોહદ્દીસે જુરી કહે છે : ફાઝીલ અને દાનીશાવર મીરજા ઈબ્રાહીમ શીરાજી હાઇક્રીઓ અરીજાને લગતો એક કીર્ત્સો વર્ણાત્મ્યો છે. તેઓ કહે છે, હું શીરાજમાં રહેતો હતો અને મારી એક ખુબ જરૂરી હાજત હતી, અને આ હાજત પૂરી થવા માટે ડોઈ રક્ષતો નજર ન હોતો આવતો અને મારી એક હાજત હ.ઇ.હુસૈન (અ.સ.)ની જિયારતનો શરૂઆત મેળવવાની પણ હતી. આ માટે હું સખત પરેશાન હતો, અને આ હાજત પૂરી થવા માટે મને એક રક્ષતો નજર આવતો હતો, અને તે રક્ષતો હતો, મહેરબાની અને ઈનાયતના સાગર હ.ઇ.ઝમાના અ.સ.ની બારગાહમાં ઈસ્તેગાસાહ કરું અને અને અરીજા લખું અને અરીજામાં હાજત લખી નાખું, અને મે એવું કર્યું અને મગરીબના વખતે છુપાઈને શહેર ની બહાર નીકળ્યો, અને એક છૌકના કીનારે આત્મ્યો (અને જેવી રીતે રીવાયતો

માં બયાન કરવામાં આત્મયુ છે. તેવી રીતે મે નવ્વાબે અરબા (ચાર નાઓબો માંથી) અબુલ હસ્સીમ ૪.હુસૈન જીન રહ્યને અવાજ આપી અને સલામ કરી અને કહ્યું: આ અરીઝાને મારા તથા તમામ દ્રષ્ટાનોના સૈયદો સરદારની ખીદમતમાં પહોંચાડી દેજો, અને પણી મે અરીઝાને પાણીમાં નાખી દીધો, અને શહેરમાં પાછો ચાલ્યો આત્મો.

સુરજ દુબી ચુક્યો હતો, અને હુ બીજ દરવાજે થી શહેરમાં દાખલ થયો અને ઘરે પાછો ચાલ્યો અને આ વાત મે ડોઇને પણ ક્હી ન હતી. બીજ દીવસે સવારના પહોરમાં થોડા આદમીઓ સાથે મારા ઉસ્તાદની પાસે ગયો, જેની પાસે હું ઈલ્મ હંસીલ કર્તો હતો. હું અને બધા આદમીઓ ઉસ્તાદ પાસે બેઠી ગયા.

એટલામાંજ એક શરીર અને પાડ સૈયદ હ.હુસૈનના ખાદીમોના કપડામાં દાખલ થયા અને ઉસ્તાદની એકદમ નજીદીક બેસી ગયા. આ સૈયદને અમો એ કયારેય પણ નહોતા જોયા અને

ઓળખતા પણ ન હતા તેઓએ મારી સામે ધ્યાન આપ્યું, અને મારા નામથી અવાજ આપી અને કહ્યું: તમારી અરીઝા હ.ઇમામ અર્ર અરવાહોના ફીદાની ખીદમતમાં પહોંચાડી દીધો. હું તેઓના શરૂદોથી હેબતાઈ ગયો અને બેઠેલા લોડો પણ તેઓની વાત ન સમજુ શક્યા, કે તેઓ શું કહી રહ્યા છે. અને લોડો પૂછવા લાગ્યા વાત શું છે?

તેઓ કે કહ્યું: ડાલે રાત્રે મે સ્વાનનમાં જોયું કે અમૃક લોડો સલમાને મોહમ્મદીની આજુબાજુમાં ઉભા છે. અને તેઓ પાસે ઘણી બધી અરીઝાઓ હતી, અને તેઓ તેને જોઈ રહ્યા હતા. જ્યારે તેઓએ મને જોયો તો મને બોલાત્યો અને કહ્યું કે ફ્લાણા (ઇબ્રાહિમ શીરાઝી) ની પાસે જાઓ અને કહો તમારી અરીઝા (અને પછી મને તેનો હાથ ઉંચો કરી અને દેખાડ્યુ કે અરીઝા પર મહોર લાગેલી હતી) હ.ઇ.હુસૈન (અ.સ.) ની ખીદમતમાં પહોંચી ગઈ છે. અમે સમજુ ગયા કે જેણી હાજત પૂરી થઈ જય છે, તેણી અરીઝા પર મહોર લગાડી

દેવામાં આવે છે. અને જેની હાજત પૂરી નથી થતી તેની અરીઝા પાછી ફરી જાય છે.

હાજર રહેલા લોકોએ સ્વખાએ વિષે પૂછ્યું, તો મે મારો (અરીઝા) વિષેનો આખો બનાવ વણ્ણાત્યો અને કસમ ખાઇને કહ્યું કે મે મારી અરીઝાની વાત મે કોઈને કહી નથી. લોકોએ મને મુખાડબાદી આપી કે તમારી હાજત પૂરી થઈ ગઈ. અને થયુ એવુજ કે અમૃત સમય પસાર થયા પછી હું ઈ.હુસૈન (અ.સ.) ના રોડા તરફ જવામાં સહજ થયો અને ઈ.હુસૈનના હરમમાં રહેવા લાગ્યો અને અરીઝામાં લખેલી બીજી હાજતો પણ પૂરી થઈ ગઈ. હું અધ્યાધના શુક ગુજરાત છું અને અધ્યાધના અવલીયા પર દુર્દેશ મોકલું છું. (સહીફાએ મછી પેજ:-૩૭૦)

પ્રકરણ - ૭ “નમાક”

શૈખ તુસી અને શૈખ તબર્કીએ ઝોંકીથી રીવાયત કરી છે. કે ઝોંકી કહે છે કે મે સાહેબુલ અમ્ર (અ.સ.)ને ખુબ શોદ્યા અને આ શોદ્યખોળ મિઝાનુલ હિકમત - 35

પાછળ ખુબ માલ ખર્ચ કર્યો પણ હું ઈમામ (અ.સ.) ની મુલાકાતથી મહેરભૂમ રહ્યો. પછી હું મોહમ્મદ જીન ઉર્માન અમૃતી જે ઈ.જમાના (અ.સ.)ના નાખેબ હતા. તેઓની ખીદમતમાં પહોંચી અને તેઓની મે એક મુદત સુધી ખીદમત કરી (અને ત્યાં રહેવા લાગ્યો) એક દિવસ મે ઈંમત કરીને મે ૫. મોહમ્મદ જીન ઉર્માનને વિનંતી કરી કે તેઓ મને ઈ.જમાના (અ.સ.)ની ખીદમતમાં પહોંચાડે તો તેમણે રૂપાં ના પાડી દીધી. મે ખુબજ આજુજુ કરી, પછી તેઓએ કહ્યું તમે કાલે સવારે આવજો.

હું બીજ દીવસે સવારે તેઓ પાસે ગયો, તો જોયું કે તેઓ ખુદ મારી પાસે આવી રહ્યા હતા, અને તેઓની સાથે એક યુવાન જે ખુબસુરત અને મોઅતાર ૪.મોહમ્મદ જીન ઉર્માનની સાથે આવી રહ્યા હતા, અને તેના હાથમાં અમુક વર્સુ રાખેલી હતી. મોહમ્મદજીન ઉર્માને મને ઈશારો કરીને સમજાવ્યુદે આ એ જવાન છે, જેને તું મળવા માટે ઉત્સુક હતો. હું ઈ.જમાના અ.સ.ની ખીદમતમાં

ગયો, અને મારે જે કંઈ પુછવું હતુ તે પૂછી લીધુ. ઈમામ (અ.સ.)મે મને બધા સવાલોના જવાબ આપ્યા. અમો ચાલતા ચાલતા એક મકાનના દરવાજ પાસે પહોંચ્યા ઈમામ (અ.સ.)મકાનમાં દાખલ થવા લાગ્યા ત્યારે જ.મોહમ્મદે મને કહ્યું, અગર તમારે કોઈ સવાલ હોય તો હજરત (અ.સ)થી પુછી લો કારણ કે તમો હવે પછી ડયારે પણ ઈમામ (અ.સ.)ને મળી શકશો નહીં.

મે સવાલ કરવા ચાહ્યું પણ ઈ.જમાના (અ.સ.)ઓ મારી તરફ ધ્યાન આપ્યુ નહીં, અને મકાનમાં દાખલ થઈ ગયા, પણ મકાનમાં દાખલ થતા થતા તેમણે આ પ્રમાણે ફરમાવ્યું, “મલઉન છે મલઉન છે તે કે જે નમાજે મગરીબમાં એટલુ મોડુ કરે કે આસમાના સીતારા દેખાવા લાગે અને મલઉન છે મલઉન છે તે કે જે નમાજે સુજ્હમાં એટલુ મોડુ કરે કે સીતારા આથમી જય. (હજ્જુલ ચકીન ભાગ :- ૨, પે૪-૩૪૪)

પ્રકરણ - ૮ લડવાની બિમારીમાં શિક્ષા

આ બનાવ હીજરી સાન અપણ નો છે. અદ્યુત રહેમાન બીજા ઈભાઈમ કબાઅડી કહે છે. કે હું હીણા શહેરમાં આ વાત સાંભળતો રહેતો હતો કે કારી નજીમુદીન જાફર બીજા ઝોછરીને લડવા થઈ ગયો છે. અને તેના પિતાનું મૃત્યુ થઈ ચુક્યુ છે. અને કારી નજીમુદીનના દાદી તેના ઈલાજ માટે ઘણી બધી કોશીખો કરે છે, પણ તેઓને શિક્ષા મળતી નથી.

લોકો એ તેના દાદીને કહ્યુ કે તેઓ નજીમુદીનના ઈલાજ માટે બગદાદના તબીબોને દેખાડે. તેણીએ બગદાદના તબીબોને બોલાત્યા અને આ તબીબોએ એક લાંબા સમય સુધી નજીમુદીનની સારવાર કરી પણ પરીણામ કંઈ ન આત્યું અને નજીમુદીનને તદુરરૂપી ન મળી. પછી અમુક લોકોએ સલાહ આપી કે તમે નજીમુદીનને હીણામાં જે મકામે સાહેબુઝમાન (અ.સ.)માં જે કુલ્બો છે. ત્યાં નજીમુદીનને શા માટે લઈ નથી

જતા? શક્ય છે કે અધ્યાહ તાત્ત્વા તેમને ત્યાં શીક્ષા આપી દે.

તેઓએ એવું જ કર્યું. એક રાત્રીના તેઓ નજીમુદીનને ત્યાં મુકી આત્મા તો ઈમામે ઝમાના (અ.સ.)એ નજીમુદીનને તેના પગ પર ઉભો કરી દીઘો અને તેની બીમારી દુર થઈ ગઈ. આ બનાવ તો મે બીજથી સાંભળેલો હતો પરંતુ એક દીવસ મારી મુલાકાત નજીમુદીનથી થઈ ગઈ, તો તેઓએ મને કહ્યું, કે એક રાત્રીના મારા દાઢી મને કુલ્બાની અંદર લઈ જઈને મને એકલો છોડી દીઘો ત્યાં એ.ઇ.સાહેબુજ્ઞામાન (અ.સ.)તશરીફ લાત્યા અને તેઓએ મને કહ્યું, ખુદાના હુકમથી ઉભો થઈ જ.આત્મુ કટી આપ (અ.સ.)એ મને ટેકો આપી ને ઉભો કરી દીઘો, અને મારી લક્વાની બીમારી જતી રહી.

જ્યારે લોકોને આ વાતની ખબર પડી તો મારી માટે જન બચાવવી મુશ્કેલ થઈ ગઈ, મારા શરીર પરના કપડાના લીરે લીરા કરી નાખી અને

તેના કટકાઓને લોકો તબરડકના તોર પર સાથે લઈ ગયા. મારા શરીર પર એક પણ કપડુ સલામત રહ્યું નથીં. પછી અમૃત લોકોએ મને કપડા આપ્યા, અને તે પહેલીને હું ઘરે ગયો અને પછી તેઓના કપડા પરત કરી દીધા.(બેહાડુલ અન્વાર ભાગ-૧૧ ઉદ્દે પેજ : ૫૮૫).

પ્રકરણ - ૯ ઈમામે વકત દીલની વાતોને જણો છે.

એહેમદબીન અલી રવણ કહે છે, કે અહેલે દીલનુરમાંથી એક ઔરતે મને બોલાવ્યો. હું તેના ઘરે પહોંચ્યો તો તે ઔરતે મને રહ્યુ કે : અય ઈજને અલી રવણ તમારી અમારા શહેરના દીનદાર, જાહીદ અને મુતાકી આદમી ઓમાં ગણત્રી થાય છે. તેથી હું એક અમાનત તમોને આપવા ચાહું છું, અને મને ઉમ્મીદ છે કે તમે તમારા વચન પર બાકી રહેશો. (ખરેખર આ ઔરત જેણું નામ આતેકા છે. તે એક થેલી ઈ.જમાના(અ.સ.)ના

“સફ્ટીર”ને પહોંચડવા માગે છે. અને સાચા ધ્યાન સુધી પહોંચડવાની કોશીષ કરે છે.)

મે કહ્યુઃ ધ્યાનાભદ્રાહ હું તેમજ કરીશ. તે ઔરતે કહ્યુઃ “આ થેલી છે તેમાં અમુક દીર્ઘમની રકમ છે. આને ખોલીને જેતા નઈી ત્યાં સુધી કે એ શખ્સ સુધી પહોંચી જવ કે જે તમને બતાવી હે કે આ થેલીમાં શું છે? અને આ થેલીમાં મારાં એક ગોશવારા (કાન ની બુટી)પણ છે. જે દસ દીનાર ની બરોબર છે. અને ઝવેરાતના ગ્રણ દાંગીના (મોતીઓ) છે. તે પણ દસ દીનારની બરોબર છે. અને બીજુ એક મારે ઈ.સાહેબુઝાંમાન (અ.સ.) એક વાત જણવી છે પણ હું ચાહુ છું કે હું સવાલ કર્યું તે પહેલા તેઓ (અ.સ) જવાબ આપી હે.” મે કહ્યુઃ તમે તેઓ (અ.સ.)ને શું પૂછવા માંગો છો? તે ઔરતે કહ્યુઃ મારી શાદી માટે મારી મા એ કોઈ પાસે થી દસ દીનારનું કર્ય લીધુ હતું. અને મને ખબર નથી કે તેણે કોણી પાસેથી કર્ય લીધુ હતું.

જેથી હું તે કર્ઝ ચુકવી શકુ. જે કોઈ તમને આ વાત બતાવી દે તેને આ થેલી આપી દેંણે.

પછી મે બધો માલ લીધો અને પછી આ થેલી લઈને હું બગદાદ પહોંચ્યો ત્યાં હું હાજી વશાઈના ઘરે પહોંચ્યો અને સલામ કરીને બેસી ગયો. તેઓએ પૂછ્યું :- શું તમારે કઇ કામ છે.? મે કહ્યું :- જ્હા. આ માલ મારે પહોંચાડવાનો છે. પણ એ શર્ત છે ,કે જ્યાં સુધી તમોએ ન બતાવી આપો કે આમાં કેટલો માલ છે. અને કોણે દીધો છે? ત્યાં સુધી હું આ માલને તમારે હવાલે નહીં કર્દ. જે તમે અત્યારે બતાવી દો તો હું આ માલ તમને અત્યારે જ આપી રજી હાજરે કહ્યું : અય અહુમદ જીન રવા આ કામ માટે તમે સામર્કરા જવ. મે કહ્યુઃ- લા એલાહ ઈલ્લાહ આતો આનાથી પણ બહેતર છે. જે હું વિચારી રહ્યો છું. પછી હું ત્યાંથી સામર્કરા ગયો અને હું વિચારતો હતો કે પહેલા જાફર પાસે જઉ પછી વીચાર્યુ કે નહીં પહેલા ઈ. હસન અર્કરી (અ.સ.)ના ઘર વાળા પાસે

જી. અને ત્યાંથી મારો મકસદ પૂરો થઇ જય. નહીંતર પછી જાફુર પાસે જી.આ ઈરાદાથી હું એ.ઈ.અબુ મોહમ્મદ હસન અર્કવી (અ.સ.)ના ઘરે ગયો.

હું ઘરે પહોંચ્યો તો ઘરમાંથી એક ખાઈમ બહાર નીકળ્યો અને કહ્યું: શું તમો અહમદજીન રવણ છો? મે કહ્યું: હા ખાઈમે કહ્યું: ટીક છે. આ પત્ર લો અને વાંચી લો. મે પત્ર વાંચ્યો તો એમાં આ પ્રમાણે લખેલું હતું.

“બીજીસીધાં હીર રહમાનીર રહીમ. અય અહમદ જીન રવણ! આતેકા બીજે દીધરાની એ તમોને એક થેલી સોપી છે. તમારા ખ્યાલ પ્રમાણે થેલીમાં એક હજર દીરહમ છે. પરંતુ તમારો ખ્યાલ ખોટો છે. એવું નથી તમને એક અમાનત આપવામાં આવી હતી. જેને તમે ખોલીને જોઈ નથી. તેથી તમને શું ખબર પડે કે તેમા કેટલી રકમ છે. આ સીવાય તમારી પાસે એક ગોશવારા (કાનનીબુટી) છે. તે ઔરતનો ખ્યાલ છે કે આ દસ દીનારની

કીમતના છે. આ સાચુ છે. આ ગોશવારામાં જે નંગ ઐડેલુ છે. તેની સાથે તે આટલી કીમતનું છે, અને મોતીઓની કીમત દસ દીનાર થી પણ વધુ છે. તમે તે ગોશવારા મારી ફ્લાણી ખાંડમાને આપી દેજો. મે તેને તે અતા કરી દીઘા છે.

પછી અહીં થી સીધા બગાદાએ પાછા જવ અને આ રકમ હાજરના હવાલે કરી દેજો અને તે તમને તમારી મુસાફરીના ખર્ચ પોતે જે આપે તે લઈ લેજો અને તે દસ દીનાર જેના બારામાં તે ઔરતનું ગુમાન છે. કે તેનીમાં એ તેની શાદી માટે કર્ઝ લીધું છે, અને તે ઔરતને ખબર નથી કે તે કોણી પાસેથી લીધું હતું પણ આવું નથી. તે ઔરતને ખબર છે, કે કોણી પાસેથી દસ દીનાર કર્ઝ લેવામાં આવ્યા હતા. તેનું નામ કુલસુમબીજો અહમદ છે. જે નાસેબા છે. એટલે કે દુશ્મનાને અહલે બૈત (અ.મુ.સ.) છે. અને આતેકા ચાહે છે કે તે તેણીને આ (રકમ)ન આપે પરંતુ તેની (આતેકાની) નાદાર બહેનોમાં તકસીમ કરી નાખે, અને અય

ઇજને અલી રવણ! છવે તમે જાફકરની પાસે તેની અજમાઈશ કરવા નહિ જવ પરંતુ સીધા તમારા ઘરે પાછા ચાલ્યા જવ, કેમકે તમારા કાકાનો ઈન્ટેકાલ થઈ ચુક્યો છે અને વાર્ષામાં અધાહે તેનો માલ તમારા નસીબમાં લખ્યો છે.

આ પત્ર વાંચીને હું સીધો બગાદાદ પાછો ફર્યો. તે થેલી હાજર ને સોંપી દીધી. તેણે થેલીની રકમ ગણી તો એક હજાર દીર્ઘમ અને પચાસ દીનાર હતા. પછી હાજરાં મને ત્રીસ દીનાર આપ્યા અને કહ્યું મને હુકમ મળ્યો છે કે આટલી રકમ હું તમારા ખર્ચ માટે તમોને આપુ. પછી હું ત્યાંથી મારા ઉતારે પાછો ફર્યો ત્યાં એક માણસ આત્યો અને મને ખબર આપી કે તમારા કાકા નો ઈન્ટેકાલ થઈ ચુક્યો છે, અને તમારા ઘર વાળા ચાહે છે કે તમો ઘરે પાછા ફરો. હું મારા ઘરે પાછો ફર્યો તો જેયુ કે મારા કાકાનો ઈન્ટેકાલ થઈ ચુક્યો હતો અને તેના તરફથી મને ત્રીસ હજાર દીનાર અને એક લાખ

દીર્ઘમ વારસામાં મળ્યા છે.(બેણાડલ અન્વાર
ભા.૧૧)

(ઉદ્દેશ્ય:૪૦૦થી ૪૦૪).

પ્રકરણ - ૧૦ જમાના અ.સ.ની દુઆથી પતિ પત્ની વચ્ચે સમાધાન થયું.

અબુ ગાલીબ ઝરારી કહે છે કે હું એક વખત
કુષાથી બહાર જવા નીકળ્યો અને મારી સાથે મારો
એક બીજાએ ઈમાની પણ સાથે હતો (તે જમાનો
જ. શૈખ અબુ ડાસીમ હુસૈન બીજી રઘુનો હતો. તે
ઈ.જમાના અ.સ.ના નાઓબે ખાસમાંના ત્રીજા
નાઓબ હતા, અને તેઓએ પોતાના સફીર તરીકે
અબુ જાહેર શાલમગાનીની નિયુક્ત કર્યા હતા.
તેઓ લોકોની હાજત અને મસાઓલ હુસૈનબીજીન
રઘ સુધી પહોંચાડતા હતા.

મારા દોષ્ટે મનો કહ્યુઃ શું તમો અબુ જાહેર
શાલમગાની પાસે મારી સાથે આવશો. આજ કાલ
તેઓજ વસીલા તરીકે છે.અને મારો ઈરાદો છે કે હું

તેઓને વિનંતી કરું કે તેઓ બાર્ગાહે ઈ.જમાના અ.સ.માં મારી હાજર પહોંચાડે. મે કહ્યું હા ચાલો.પછી અમો તેના પાસે ગયા અને તેઓની બેઠકમાં જોયુ તો અમારા ઘણા બધા દોષ્ટો બેઠેલા હતા. અમે બંનેઓ બેઠકમાં જૃદ અને સલામ કરીને બેઠા.

અખુ જાફર શાલમાગાની એ મારી સામે જોયુ અને મારા બારામાં પૂછયુઃ આ જવાન કોણ છે? મારા દોષ્ટો જવાબ આપ્યો આ આલે ઝરારાહા (કબીલા)નો એક માણસ છે.પછી તેઓએ મને પૂછયું ઝરારાહ કુટુંબમાંથી તમે કોના ફરંદ છો? મે કહ્યું જનાબ હું ઝરારાહના ભાઈ બડીર બીન અધિનનો પુત્રછું. તેઓએ કહ્યું, હા તેઓનું કુટુંબ મજહબી મામલામાં જલીલુલ કરું છે. ત્યાર બાદ મારા સાથીએ તેઓને અર્જ કરી: જનાબ હું ઈચ્છું છુ કે તમો મારા એક કામ માટે અરીજામાં મારા માટે દુઆ કરવાની વિનંતી કરો. તેઓએ કહ્યું ઠીક છે.

મે જ્યારે આ સાંભળ્યું તો મારા દીલમાં પણ ઈચ્છા થઈ કે હું પણ અરીજા લખુ અને મારા દીલમાં આ બાબત લખવાની ઈચ્છા હતી કે મારી પત્ની જે મારાથી ખુબ નારાજ હતી (અને તે તેના પિયર ચાલી ગઈ હતી) અને તેણી માટે મારા દીલમાં મોહંબત હતી. તેના માટે દુઆની વિનંતી કરું અને આ વાત મે ડોઇને પણ બતાવી ન હતી. તેથી મે નકડી કર્યું કે આ વાત હું અરીજા માં પણ જણાવું નહીં. પછી મે કહ્યુઃ - અષાઢ તાલા હંમેશા આપને જીવંત અને સલામત રાખે. મારી પણ એક હાજત છે. તેઓએ પુછ્યું શું હાજત છે?

મે કહ્યું મારી હાજત મારા દીલમાં છે. અને તેના માટે દુઆની વિનંતી છે. તેઓએ તેમની સામે રાખેલ એક કાગળ ઉપાડ્યો. તેમાં લોકોની હાજતો લખેલી હતી. તેના પર તેમણે લખ્યું કે તેના દીલમાં જે હાજત છે, તેના માટે દુઆ ચાહે છે. એ પછી તેઓએ કાગળ વાળીને મુકી દીધો અને અમોત્યાંથી ચાલ્યા ગયા.

થોડા દીવસો પછી મારા સાથીએ મને કહ્યુ, શું અબુ જાહેર પાસે નથી જતું? જેથી આપણે જણીતો શકીએ કે આપણી હાજતોના બારામાં શું જવાબ આત્યો છે.? પછી અમે બજો અબુ જાહેર પાસે ગયા અને સલામ કરીને બેસી ગયા. તેઓએ અમને જોઈને કાગળ કાઢ્યો જેમાં બધા મસાઓલના જવાબ લખેલા હતા. પહેલા તેઓએ મારા સાથીદારના સવાલનો જવાબ વાંચ્યો સંભળાત્યો. પછી મારા તરફ ફરીને આ જવાબ વાંચ્યો, અને રહ્યો ઝોરારીનો પ્રશ્ન તે તો પતિ પણ્ણિનો કીર્તસો છે, અને અદ્ધાર તાલાએ તે બજોની વચ્ચે સમાધાન કરાવી દીધુ છે.

આ જવાબ સાંભળીને મારા દીલ પર મોટી અસર પડી. પછી અમે લોડો ત્યાંથી પાછા ફર્યા અને પછી રહ્યામાં મારા સાથીએ મને કીધુ. હવે તને યકીન આત્યુ? મે કહ્યુ: યકીન જ નાહી પણ ખુબજ નવાઈ પણ લાગી. તેણે કહ્યુ: ઓમ કેમ? મે કીધુ આ એક રહસ્ય હતુ. જેને મારા અને અદ્ધાર

સિવાય કોઈ નહોતુ જણાતુ પણ તેઓએ તેને
દેખાડ્યુ અને તેનો ઉકેલ પણ આપી દીધો.

તેણે કહ્યુઃ શું તને ઈ.જમાના અ.સ.ના
બારામાં શક હતો? ઠીક હવે બતાવ વાત શું છે? મે
તેને મારી વાત કરી તો તેને પણ નવાઈ લાગી. પછી
હું જ્યારે કુષ્ણ પાછો ગયો અને જ્યારે મારા
આવવાની ખબર ઉમે અલી અઘાસ (મારી
પત્ની)ને પડી કે જે મારાથી નારાજ થઈને તેના
પિયર જતી રહી હતી. તે ખુદ મારી પાસે આવી
અને મને મનાવવાની કોશીષ કરવા લાગી અને
મારી માઝી માંગી અને હું પણ તેનાથી રાજ થઈ
ગયો. અને અમારા બન્ધેનું સમાધાન થઈ
ગયું. પછી તેણીએ મરતે દમ સુધી કયારે પણ મારી
નાફુરમાની, વિરોધ નથી કર્યો. (બેછાડુલ
અનવાર (ઉદ્દુ) ભાગ:-૧૧)

પ્રકરણ - ૧૧ એક તાલીબે ઈલ્મની ઈમામ (અ.સ.)થી મુલાકાત

આગા મીર્જા હાઈ બજસ્ટાની પોતાના એક ભરોસા પાત્ર તાલીબે ઈલ્મથી આ બનાવને લખે છે. કહે છે કે હું મારી માતાની સાથે કલ્યાણિ અને ખાનકીનાં માર્ગ થઈ હવે મુખારકની કિયારત માટે કાફેલા સાથે ગયો. ખાનકીનાં રક્તા ઉપર કાફુલાથી અલગ પડી ગયો અને રક્તો ભુલી ગયો. હું આમ તેમ દોડતો હતો અને મુંજવણમાં હતો કે આ રક્તો કઈ રીતે પસાર કર્યા હતું. હું થાકી ગયો અને લાચાર થઈ ગયો. મારા પગોમાં તાકાત ન રહી. માટે હું એક જગ્યા ઉપર જઈ બેસી ગયો ત્યાં મે એક એવા વ્યક્તિને જોયો કે જેનાં હાથમાં ખંજર હતું. ઓ શખસથી એટલો કરી ગયો કે કરીબ હતું કે મારી રુંધ મારા શરીરમાંથી નીકળી જય.

આવી હાલતમાં મે ત્રણ વાર કહ્યું “ચા અબા સાલેછ અદરીકની” અને ચોથી વાર કહ્યું “આ અબલ ગત્સ અગીસની”. અચાનક મે મારી મિઝાનુલ હિકમત - 51 HAJINAJI.com

જાતને તેનાથી દુર બીજ રક્ષતા પર જોઈ. હુ ખુબજ ભુખ્યો થયો હતો. મે અદ્ધાહથી દુઆ કરી “અય પરવરદીગાર તેજ કહ્યુ છે, કે મારો બંદો જ્યાં પણ હશે. હું તેને રોડી અતા કરીશ”. અચાનક મે જોયુકે સામેથી એક અરબી શાખ્સ આવી રહ્યા હતા. જેનું દામન રોટીઓથી ભરેલુ હતુ. મે તેમને કહ્યુ તમે આ રોટીઓને એક અનામ(ઇચાડી નાણુ)માં મને વેચો. મે તેમને પૈસા આપ્યા અને તેમણે મને રોટીઓ આપી દીધી. ત્યાર પછી હું ત્યાં આવેલા મશહુર અને લીલાઇમ કીદ્ધામાં ગયો. ત્યાં મે એક બીજ અરબી શાખ્સને જોયા તેમણે મને કહ્યુ કે તુ હજુ સુધી પાઇળ કેમ રહી ગયો છે?

મે કહ્યુ કે હુ મજબુર છું, મારી પાસે કાફ્લા સુધી પહોંચવાનો કોઈ રક્ષતો નથી. તેમણે કહ્યુ જલ્દી કર. હજુ તેમનાં આ શાઢોની પુરા નહોતા થયા કે મે જોયુ કે તેમનાં શાઢોની બરકતથી હું ખાનકીનમાં પહોંચી ગયો હતો. હુ કાફ્લામાં ભળી ગયો. મારી માતા સાથે મુલાકાત કરી ખુબ ખુશ

થયો. મે મારી માતાને પુછ્યુ કે તમે કયા સમયે
ખુબજ પરેશાન થયા હતા? તેમણે કહ્યુ કે હુ તારી
જુદાઈમાં ફ્લાણા સમયે ખુબ ચીંતિત થઈ અને
એવી હાલતમાં અધ્યાધ્યાથી ગીર્યાઓ જરી કરી કે
એક નુર ફેલાણુ અને થોડી વારમાં તુ અહીં પહોંચી
ગયો. હુ સમજ ગઈ કે અધ્યાધ ત.વ.ત. એ આ
નુરની બરકતથી તને મારા સુધી પહોંચાડી દીધો.

(બરકાતે ઈમામ (અ.સ.) પેજ. ૨૦૮.)

પ્રકરણ - ૧૨ ઈમામ હુસૈન (અ.સ.)ના રોકાનાં ખાદીમને મુલાકાત

શોખ હુસૈન કે જે નેક મુતકી પરહેઝગાર અને
ભરોસાપાત્ર વ્યક્તિ હતા. તેઓ ઈ.હુસૈન
(અ.સ.)નાં રોકાના મુજાવર હતા અને દેખરેખ
રાખતા હતા અને ઈ.હુસૈન (અ.સ.)નાં ખાદીમોમાં
સૌથી જુના હતા. તેઓ બયાન કરે છે કે

હુ અને મહુર્મ સૈ.હાશીમ કે જે નાઅબે
મુતવહ્યી હતા, જેમનાથી જવાબદારી રોકાને

મુખ્યારકનાં દરવાજા ખોલવાની અને બંધ કરવાની હતી. અમે બઝે સેહને મુક્કદૃદ્ધસમાં રહેતા. અમારો નિત્યક્રમ એ હતો કે અમે બઝે રાતનાં પ્રથમ હિસ્સામાં હરમે મુક્કદૃદ્ધસનાં તમામ ફુમણી ચારે બાજુ તપાસ કરી લેતા કે કોઈ અંદર બાડી નથી રહી ગયું ને. ત્યાર બાદ અમે હરમના દરવાજાઓને બંધ કરી દેતા.

એક રાત્રે રોજનાં ક્રમ મુજબ અમે તમામ સહેનમાં તપાસ કરી જ્યારે કોઈ જત્વારને અંદર ન જોયા પછી અમે દરવાજાઓને બંધ કરી દીધા. એ રાત્રે હું વહેલો ઉઠી ગયો અને મે સૈ હાશીમને ઉઠાડ્યા અને કહ્યું કે જત્વારો માટે દરવાજા ખોલવાને અડધી કલાકની વાર છે. માટે આપણે નમાજ પઢી લઈએ અને જત્વારોને આવવાનો સમય થાય એટલે દરવાજા ખોલી નાખશું.

અમે સહેનમાંથી હરમ તરફ ગયા અને હરમનો જે દરવાજો જરીહે મુક્કદૃદ્ધસની સામે પડતો હતો એ દરવાજો ખોલ્યો, અને અંદર દાખલ થયા.

રોકાની નજીદી ગયા ત્યારે જોયુ કે એક નુરાની શપસ ઉભા છે. જે નમાઝમાં કુનુતની હાલતમાં મશ્ગુલ છે. સૈયદ હાશીમે મને કહ્યુ કે શુ રાત્રીનાં દરવાજાઓ બંધ કરતી વખતે તમે તપાસ નહોતી કરી. મે કહ્યું કે મે સંપૂર્ણ રીતે તપાસ કરી હતી પરંતુ હરમની અંદરતો કોઈ ન હતુ. સૈયદ હાશીમે કહ્યુ તમે ચીરાગ લઈ આવો હુ આ વ્યક્તિના ચેહરાને જોવ જેથી તેને ઓળખી શકાય. હું ચીરાગ લાત્યો. તેમણે નજર કરી પરંતુ ઓળખી ન શકયા અને કહ્યુ હું આ વ્યક્તિને નથી ઓળખતો અને મે ઓમને કયારેય જોયા નથી.

અમે બદ્લે તેમની નમાઝ પુરી થવાની રાહ જોઈ ઉભા રહ્યા. ઘણીવાર થઈ અમે ઉભા ઉભા થાકી ગયા, પરંતુ તેઓ હજુ સુધી ઓમજ કુનુતની હાલતમાં ઉભા હતા. સૈ. હાશીમે કહ્યુ આપણે હરમની અંદર તપાસ કરી લઈએ કે બીજુ પણ કોઈ અંદર નથીને. અમે અંદર જઈ ઝરીછની પાછળના ભાગમાં તપાસ કરી જ્યારે એ વ્યક્તિ તરફ પાછા

જ્યાર્હા તો જેયુ કે તેઓ ગાયબ છે. ત્યાં હાજર નથી. અમે તેમને ગોતવા લાગ્યા પરંતુ તેમનું કયાય નામો નીશાન ન હતુ.

સૈ. હાશીમે કહ્યુ તમામ દરવાજાઓ બંધ છે. તો પછી આ વ્યક્તિ કયાંથી નીકળી ગયા? પછી સૈ. હાશીમે પોતાના અમામાને માથા પરથી ઉતારી ફેરી દીઘો અને સર પીઠવા લાગ્યા. મે કહ્યુ સૈ. હાશીમ તમને શું થઈ ગયું? તેમણે કહ્યુ મને ચકીન થઈ ગયુ કે આ સરયદ આપણા મૌલા છ. હુજુઝત (અ.ત.જ.શ.) હતા. પરંતુ આપણે તેમને ઓળખી ન શક્યા. પછી અમે ખુબ રડ્યા અને થોડી વારમાં જત્વારોનો આવવાનો સમય થઈ ગયો. માટે અમે દરવાજાઓ ખોલી નાખ્યા. (બરકાતે ઈમામ (અ.સ.) પેજ. ૨૩૦).

પ્રકરણ - ૧૩ મોહમ્મદ (સ.અ.વ.) અને મુસલમાનોના બે સમૂહ

મોહમ્મદ (સ.અ.વ.) મદીનાની મર્ઝિદમાં દાખલ થયા. તો તેમની નજર બે સમૂહ ઊપર પડી, કે જેઓ ભેગા મળીને કશુંક કામ કરી રહ્યા હતા. જેમાંથી એક સમૂહ અલ્લાહની ઈબાદત (બંદગી) કરી રહ્યું હતું, જ્યારે બીજા સમૂહના લોકો પોતે કશું શીખી રહ્યા હતા અને બીજાને શીખવાડતા હતા એટલે બીજા સમૂહના લોકો ઈલમની ચર્ચા કરતા હતા. મોહમ્મદ (સ.અ.વ.) આ બંને સમૂહને જોઈને (તેમના કાર્યને જોઈને) ખુબ ખુશ થયા અને પોતાના સાથીદારો તરફ જોઈને કહ્યું કે આ બંને ગુપના

લોકો નેક કામ કરી રહ્યા છે, અને નેકીના રસ્તા પર ચાલી રહ્યા છે.

આપે પોતાની વાત આગળ વધારતા કહું
પરંતુ મને લોકોને શિક્ષણ આપવા અને
લોકોને બાઅખલાક બનાવવા માટે
મોકલવામાં આવ્યો છે. આ વાક્ય બોલતા
બોલતા આપ (સ.અ.વ.) ઈલમની ચર્ચા કરતા
ગુપ પાસે ગયા અને તે લોકો સાથે કાર્ય કરવા
લાગ્યા (મનીયતુલ મુરીદ પૃષ્ઠ - ૧૦ મુંબઈ
પ્રકાશન) (સચ્ચી કહાનીયા ભાગ:૧ પેજ ૧૯)

પ્રકરણ - ૧૪ મહેનતનું ફળ

જયારે તે પોતાના અગાઉના સમયને
યાદ કરતો ત્યારે તેને પોતાના દુઃખ ભર્યા
મિઝાનુલ હિકમત - 58

દિવસો યાદ આવતા. જે દિવસોમાં તે પોતાની પત્ની અને બાળકોને પૂરતું ખાવાપીવાનું પણ લાવી શકતો નહિ, અને માસુમ બાળકો ભૂખથી તડપ્યા કરતા તે મનમાં એક વાક્ય પર વિચાર કરતો, જેના કારણે ઊંઘ હરામ થઇ ગઈ હતી. આ એક જ વાક્ય એવું હતું કે જેને તેનામાં અસાધારણ રૂહાની શક્તિ પૈદા કરી દીધી હતી. અને તેનું જીવન બદલી નાખ્યું. તેનું દુઃખી જીવન સુખમાં (ખુશીમાં) ફેરવાય ગયું હતું અને તેઓ ગરીબીથી ભરેલું જીવન જીવતા હતા, આ એક વાક્યની બરકતે તેનું જીવન શાંતિમય સુખદાયી બનાવી દીધું.

આ માણસ બીજો કઈ નહિ પણ મોહમ્મદ
(સ.અ.વ.)નો સહાબી હતો. તે ગરીબ હતો. એક
દિવસ તે સંસારના દુઃકહો અને તકલીફોથી
ખુબજ પરેશાન થઈ ગયો ત્યારે તેની પણીએ
સલાહ આપી કે તમે મોહમ્મદ (સ.અ.વ.) પાસે
જઈને આપણી ગરીબી અને દુઃખની વાત કરો.
પછી તેને નક્કી કર્યુ કે તે પોતે મોહમ્મદ
(સ.)ને પોતાની મુશ્કેલીઓ જણાવશે અને
તેમની પાસે મદદ માંગશે.

આ વાત નક્કી કરી તે માણસ હઝરત
મોહમ્મદ (સ.) પાસે જાય છે. પરંતુ તે માણસ
કાંઈ બોલે તે પહેલા જ મોહમ્મદ (સ.)એ કહ્યું
કે અગાર કાંઈને કાંઈ હાજત (જરૂરિયાત) હોય

અને અમારાથી સવાલ કરશે તો અમે બેશક તેની મદદ કરશું પણ અગાર તે માણસ અલ્લાહ પાસે મદદ માંગો (અલ્લાહથી હાજત માંગો) તો અલ્લાહ તેને એટલું આપશે કે તેને કોઈની પાસે મદદ માંગવી પડશે નહીં. આ વાક્ય સાંભળીને તે માણસ મોહમ્મદ (સ.)ને કશું કહી શક્યો નહીં અને પોતાના ઘરે પાછો ફયો.

ઘરે પહોંચીને તેણે ઘરમાં ભૂખ અને ગરીબીનું વાતાવરણ જોયું. વિવશ થઈને ફરીવાર આર્થિક મદદના હેતુથી તે માણસ મોહમ્મદ (સ.)ની પાસે ગયો તે દિવસે પણ મોહમ્મદ (સ.)એ આ જ વાક્ય કહ્યું કે અગાર

કોઈ અમારાથી સવાલ કરે તો અમે તેની હાજત પૂરી કરશું પણ અગાર જો કોઈ અલ્લાહથી હાજત (જરૂરિયાત) માંગે તો અલ્લાહ તેને એટલું આપશે કે તેને ફરીવાર બીજા પાસે માંગવું નહીં પડે.

આ વખતે પણ તે પોતાની હાજત બચાન કર્યા વિના પોતાના ઘરે પાછો આવી ગયો. ઘરની ખૂબજ ખરાબ હાલત હતી. બાળકો ભૂખ ઘ્યાસથી તડપતા હતા. ઘરની આ હાલત અને દુઃખોથી પરેશાન તે માણસ ફરી મોહમ્મદ (સ.) પાસે જાય છે. ફરી એકવાર મોહમ્મદ (સ.અ.વ.)ની મુખારક ઝબાન પરથી આ જ વાક્ય સાંભળે છે. આ વખતે મોહમ્મદ મિઝાનુલ હિકમત - 62

(સ.અ.વ.)ના આ વાક્યને સાંભળીને તેના મનને અસાધારણ શાંતિ મળી. તેને લાગ્યું કે આ વાક્ય મારા તમામ દુઃકહો દૂર કરવાની ચાવી છે. આ વખતે તે હઝરત મોહમ્મદ (સ.અ.વ.) પાસેથી ઉભો થયો ત્યારે તે ખૂબ શાંતિ (આરામ)ની લાગણી અનુભવી રહ્યો હતો.

તે ખૂબજ હિંમત સાથે પોતાના ઘર તરફ આગળ વધ્યો. રસ્તામાં તેના મનમાં વિચારી રહ્યો હતો કે હું ક્યારેય કોઈ વ્યક્તિ પાસે હાથ લાંબો નહીં કરું. અગર માંગવું જ હશે, તો અલ્લાહથી માંગીશ અને તેના પર ભરોસો રાખીને તેની આપેલી શક્તિથી કામ કરીશા

ત्यारपछी અલ્લાહ પાસે દુઓ કરીશ કે અય
અલ્લાહ ! તું મારા કામમાં સફળતા આપજો
અને મને હંમેશા માટે કોઈનો મોહતાજ નહીં
બનાવતો. ત્યારપછી આ માણસે વિચાર
કરવાનું શરૂ કર્યું કે હું શું કામ કરી શકું.

તુરંત જ તેના મનમાં વિચાર આવ્યો કે
પોતે જંગલમાંથી લાકડા લાવીને બજારમાં
વેચી દેશે. તેણે પોતાના પાડોશી પાસેથી
ઉછીની કુહાડી લીધી અને જંગલની તરફ
ચાલતો થયો. થોડી મહેનત કર્યા પછી તેણે
ઘણા બધા લાકડા ભેગા કરી લીધા અને તેને
મહેનતનું સારુ ફળ મળ્યું. પછી પણ તેણે
આગળ આ જ કાર્ય ચાલુ રાખ્યું.

ધીરે ધીરે પોતાની આકમાંથી એક કુહાડી ખરીદી લીધી. પછી થોડા દિવસો પછી પોતાની આવકમાંથી થોડા પાલતું જાનવર અને ઘરનો સમાન લીધો પરંતુ તે જંગલમાં નિયમિત લાકડા કાપવા જતો અને તેને બજારમાં વેચતો થોડા સમય પછી તે એક પૈસાદાર વેપારી બની ગયો અને થોડા નોકર પણ રાખી દીધા.

એક દિવસ મોહમ્મદ (સ.) પાસે તે માણસ ગયો અને હસતા હસતા મોહમ્મદ (સ.અ.વ.) કહ્યું, મેં નહોતું કીધું કે જે વ્યક્તિ અમારી પાસે હાજત માંગે છે તેની અમે અવશ્ય હાજત પૂરી કરીએ છીએ પરંતુ તે અગાર અલ્લાહ પાસે

હાજત ચાહે તો અલ્લાહ તેને કોઈનો મોહતાજ
નહીં બનાવે.

(ઉસુલે કાફી ભાગ:૨ પેજ.૧૩૧)

(સર્વી કહાનીયા ભાગ:૧, પેજ.૨૦થી ૨૨)

પ્રકરણ - ૧૫ દુઆની ઈચ્છા

એક માણસ ખૂબ જ દુઃખી અને મુશ્કેલીની હાલતમાં ઈમામ જાફરે સાદિક (અ.સ.) પાસે આવ્યો અને બોલ્યો કે હું ખૂબ ગરીબ અને મોહતાજ છું. આપ મારા માટે દુઆ કરો કે અલ્લાહ મારી રોકીમાં વધારો કરે અને મને દરેક મુશ્કેલીમાંથી છુટકારો મળો.

ઈમામ (અ.સ.)એ કહ્યું હું તારા માટે
હરગિજ દુઆ નહીં કરું. તે માણસે ખુબજ
નિરાશ થતા કહ્યું કે યા ઈમામ (અ.) એવું શું
કારણ છે કે જેને કારણે તમે મારા માટે દુઆ
નથી કરતા ? ઈમામ અ.સ.એ જવાબ આપ્યો.
“તું સારી રીતે જાણો છે કે અલ્લાહ આ માટે
એક રસ્તો નક્કી કર્યો છે. અને તેના
(અલ્લાહના) હુકમ પ્રમાણે રોઝીની શોધ માટે
ઘરની બહાર નીકળો અને ખુબ મહેનત કરો
આનાથી વિરુદ્ધ તું એમ ચાહે છે કે દુઆને
કારણે તું રોઝીને પોતાના ઘરે બોલાવે.
(રેફ.વસાયલ પ્રકાશન અમીર બહાદુર ભાગ:૨
પેજ.૫૨૯)

(સચ્ચી કહાનીયા ભાગ:૧ પેજ.૨૪)

પ્રકરણ - ૧૬ પોતાનું કામ પોતે કરો.

લોકોનું એક ગૃપ ઘણી મુસાફરી પૂરી કરી ચૂક્યું હતું. ગૃપની દરેક વ્યક્તિ ખુબ જ થાક અનુભવતી હતી. પશુ પણ થાકી ગયા હતા એટલે સુધી કે લોકોનો આ સમૂહ એક એવી જગ્યાએ પહોંચ્યો જ્યાં પાણી મોજુદ હતું. આ સ્થળે કાફલાને આરામ માટે રોકવામાં આવ્યો. મોહમ્મદ (સ.અ.વ.) પણ આ કાફલાના (ગૃપ)માં હતા, બધા લોકોની જેમ આપ પણ ઊંટ પરથી ઉત્તર્યા. કાફલાની દરેક વ્યક્તિ ઝડપથી પાણીથી નહેર પર પહોંચવા ઈચ્છતી

હતી. જેથી તેઓ ત્યાં વગું વગેરે કરીને નમાઝ
માટે તૈયાર થઇ જાય.

મોહમ્મદ (સ.અ.વ.) પણ ઉંટ પરથી
ઉત્તરીને પાણીની નહેર તરફ આગળ વધ્યા,
પરંતુ થોડું ચાલીને પછી કોઈને કશું કહ્યા
વિના પાછા વખ્યા અને પોતાના ઉંટ તરફ
આગળ વધ્યા. આપ (સ.)ના સાથીદારો અને
મિત્રોને લાગ્યું કે કદાચ મોહમ્મદ (સ.અ.વ.)ને
આ સ્થળ પસંદ નથી પડ્યું લાગતું અને કદાચ
આગળ ચાલવાનું કહેશે. બધાયની નજર આપ
(સ.) પર હતી. દરેક વ્યક્તિ મોહમ્મદ
(સ.અ.વ.)ની નવી સુચના સાંભળવા આતુર
હતા. પરંતુ લોકો ત્યારે નવાઈ પામ્યા જયારે

લોકોએ જોયું કે આપ (સ.)એ પોતાના દુપદ્રો
લીધો અને ઊંટની કમર બાંધવાનું શરૂ કર્યું.
આપે આ કામ ઝડપથી પુરુ કરીને નહેર તરફ
આગળ વધ્યા.

બધી બાજુથી લોકો કહેવા લાગ્યા કે યા
રસુલલ્લાહ, તમે અમને આ કામ કરવાનો
હુકમ શા માટે ન આપ્યો. અમે તમારું કાર્ય
કરીને સદભાગ્ય પ્રાપ્ત કરતે. આપે શા માટે
આ કાર્ય માટે તકલીફ ઉપાડી અને તમારે આ
કામ માટે પાછુ ફરવું પડયું અમે તો ખુબજ
ગર્વથી તન, મનથી આ કાર્ય કરી આપવા
માટે તૈયાર હતા. ઇસ્લામના પયગમ્બરે
જવાબ આપતા કહ્યું “પોતાના કામ માટે ન તો

કોઈની મદદ લેવી જોઈએ ન તો કોઈના પર
ભરોસો રાખવો જોઈએ ભલે ને એક જ દાંતન
લાવવું હોય એટલે ભલેને એકદમ નાનું કાર્ય
હોય તો પણ બીજા પર આધાર રાખવાને
બદલે પોતે જાતે આ કાર્ય કરી લેવું જોઈએ.”

(કહલુલ બસર, મોહદ્દિસે કુમ્મી પાના. ૫૬)

(સચ્ચી કહાનીયા ભાગ:૧ પેજ ૨૫, ૨૬)

પ્રકરણ - ૧૭ હજની મુસાફરીનો સાથી

એક માણસ અલ્લાહના ઘરની હજ કરીને
ઈમામ જાફરે સાદિક (અ.સ.) પાસે આવીને
પોતાની અને પોતાના મિત્રોની મુસાફરી
દરમિયાનની વાતો કરી રહ્યો હતો. પોતાના
એક સાથીદાર મિત્રની તે ખુબજ પ્રશંસા કરતો
મિઝાનુલ હિકમત - 71

હતો. તેને કણું કે ખરેખર તે ઈબાદત ગુજરાત
અને પરહેઝગાર વ્યક્તિ હતો. તે દરેક સમયે
અલ્લાહની ઈબાદતમાં લીન રહેતો હતો જ્યારે
અમે રાત્રી વીતાવવા માટે અમારો કાફલો
રોકતા કે તે તુરંત જ મુસલ્લો પાથરી દેતો
અને અલ્લાહની ઈબાદતમાં મશગુલ થઇ
જતો.

ઈમામે તે વ્યક્તિને પૂછ્યું, પછી તેના
બીજા કામ કોણ કરતા હતા ? તેના જાનવરો
ઉંટની સંભાળ કોણ રાખતું ? તેણે ઉત્તર
આપ્યો, વાત એકદમ સ્પષ્ટ છે. આ તમામ
કયો કરવાનું સૌભાગ્ય અમને પ્રાપ્ત થયું હતું.
તે તો તેની ઈબાદતના કાર્યમાં મશગુલ રહેતો

હતો. તેણે ઈબાદતના સિવાય બીજા કોઈ કામથી મતલબ ન હતો. ઈમામે જવાબ આપતા કહ્યું આજ કારણ છે કે તમે બધા ઈબાદત ગુજર અને પરહેઝગાર કરતા વધારે બેહતર છે. (સચ્ચી કહાનીયા ભાગ.૧ પેજ.૨૩)

પ્રકરણ - ૧૮ અલ્લાહ કોને દોસ્ત નથી રાખતો ?

રસુલ (સ.અ.વ.) અને આપણા સાથીદારો પોતાની સવારી (ઉંટ) પરથી નીચે ઉત્તર્યા અને પોતાનો સમાન ખોલ્યો ત્યારબાદ દરેક લોકોએ નક્કી કર્યું કે તેઓ એક બકરીની કુરબાની કરીને સાથે બેસીને જમશે. એક સાથીદારે કહ્યું બકરીની કુરબાની હું કરીશ.

બીજાએ કહ્યું તેનું ચામડું હું ઉતારી આપીશ.
ત્રીજાએ કહ્યું ગોષ્ઠ (શક) હું રાંધીશ. રસુલ
(સ.અ.વ.) બોલ્યા રસોઈ રાંધવા માટે જરૂરી
જંગલમાંથી લાકડીઓ હું લાવી આપીશ.
બધાજ આપના સાથીદારો એક અવાજે બોલી
ઉઠ્યા યા રસુલલ્લાહ ! અમારી હાજરીમાં
તમારે તકલીફ લેવાની જરૂરત નથી. અમે
લોકો ખુબજ આસાનીથી અને આનંદ પૂર્વક આ
કામ કરી લેશું.

રસુલ સાહેબે જવાબ આપ્યો, મને ખબર
છે કે તમે લોકો આ કામ સફળતાપૂર્વક કરી
લેશો, પરંતુ અલ્લાહ તે બંદાને જરાપણ દોસ્ત
નથી રાખતો કે જે પોતાની જાતને તેના

મિત્રોની વચ્ચે મહાન (ઉચ્ચ) સમજે અને
પોતાને બીજા કરતા વધારે શ્રેષ્ઠ સમજે અને
બીજાની સરખામણીમાં પોતાની જાતને વધારે
ઇઝુઝતદાર મને છે. આટલું કહીને મોહમ્મદ
(સ.અ.વ.) જુંગલ તરફ ચાલતા થયા અને
થોડીજ વારમાં લાકડીઓ અને ઘાસ લઈને
પાછા ફર્યા.

(૧) અલ કુરઆન, (૨) કોહલલ બસર

પેજ નં.૫૮

(સચ્ચી કહાનીયા પેજ-૨૩,૨૪)

નમૃતા.

મુસલમાનોનો એક કાફલો મકડા જઈ રહ્યો હતો. મદીના પહોચીને આ ગુપના લોકો ત્યાં થોડા દિવસ સુધી રોકાય ગયા. થોડા દિવસ આરામ કર્યા પછી તે લોકો મદીનાથી મકડા તરફ રવાના થયા. મકડા અને મદીનાની વર્ષે કાફલા વાળાની મુલાકાત એવા એક માણસ સાથે થઈ જે કાફલાના બધાજ માણસોને સારી રીતે ઓળખતા હતા. તે માણસ ગુપના માણસો સાથે વાતચીતમાં મશગુલ હતાં કે તેમની નજર એક માણસ પર પડી કે જે ખુબ જ ધગશાથી આ કાફલાના માણસોની સેવામાં મશગુલ હતા. તે માણસે પહેલી નજરે જ તે માણસને ઓળખી લીધા પછી તેમણે ખુબ જ નવાઈ સાથે પૂછ્યું. તમે લોકો આ માણસને ઓળખો છો? જે તમારી સેવામાં મશગુલ છે? નહીં અમે લોકો આ માણસને બિલકુલ ઓળખતા નથી.

આ માણસ તો મદીનાથી અમારા ગુપમાં જોડાયા હતા. મુસાફરીના થોડા દિવસોથી અમારી સાથે છે તે કારણે અમે એટલું કહી શકીએ છીએ કે તે એક ધ્યાદતગુજરાત, પરહેઝગાર, સેવાભાવી, અને ઉમદા માણસ છે. અમે લોકોએ તેમને અમારું કામ કરવાનું કહ્યું પણ નથી. તેઓ પોતે જતે બીજાની સેવામાં મશગુલ રહે છે. અને દરેક વ્યક્તિની મદદ પણ કરે છે. કાફળાવાળાના મિત્ર એ કહ્યું મને ખબર છે કે તમે લોકો તે માણસને જરા પણ ઓળખતા નથી. અગર તમે લોકો તેમને ઓળખી લેતે તો તમે લોકો તેની પાસે સામાન્ય નોકરની જેમ તેમની સેવા લેવાની બુલ ન કરતે. બધા લોકોએ નવાઈ સાથે પૂછ્યું કે છેવટે આ માણસ છે કોણ? તેણે જવાબ આપ્યો તે અલી ઈજને હૃસૈન (અ.સ.) એટલે ધીમામ ઝૈનુલ આબેદિન (અ.સ.) છે.

આ સાંભળીને કાફળાના બધા માણસો ખુબ ચિંતામાં પડી ગયા અને માફી માંગવાના ઉદ્દેશ્યથી,

ખુબ માન પૂર્વક ઈમામના હાથોને ચુમવા માટે તેમણી તરફ આગળ વદ્ધયા. બધા લોડોએ ઈમામની સામે હાથ જોડીને ફરીયાદ કરતા કહ્યુ, તમે અમારી સાથે આવો વ્યાઘાર શા માટે કર્યો? શક્ય છે, કે અજણતા અમારી તરફથી તમારી શાનમાં કંઈ ભુલ થઈ જત તો અમારાથી એક મોટો ગુનાંહ થઈ જત.

ઈમામ (અ.સ.) એ જવાબ આપ્યો તમે લોડો મને ઓળખતા ન હતા. તેથી ૪ મે જણી જેઇને તમારી સાથે મુસાફરી કરી કારણ કે જ્યારે હું જણીતા લોડો સાથે મુસાફરી કરું છું ત્યારે તે લોડો રસૂલ (સ.અ.વ) ના કારણે મારી સાથે પ્રેમ અને દ્યારી વર્તાવ કરે છે, અને મને નાનુ મોટું કામ કરવાની પણ રજી આપતા નથી. તેથી હું ઈચ્છતો હતો કે મારા પ્રવાસ માટે હું એવા સાથીદાર મિત્રોની પસંદગી કરું કે જેઓ મને ઓળખતા ન હોય, જેથી હું મારું કામ જતે પણ કરી શકું. લોડોને હું મારી ઓળખાણ પણ નથી આપતો જેથી મને

આ પ્રકારના મિત્રોની સેવા કરવાનું સદ્ગુર્ખાય પ્રામુખ થાય. (૧) બેહારુલ અન્વાર ભાગ-૧૧. (સર્વી કહાનીયા ભાગ-૧ પેજ ૨૫,૨૭)

પ્રકારણ – ૨૦ અખ્લાકે રસૂલે અકરમ (સ.અ.વ)

એક જંગલી અરબ મદીના શહેરમાં દાખલ થયો અને સીધો મરજીદે નબવીમાં પહોંચી ગયો ત્યાં જઈને રસૂલ (સ.અ.વ) પાસે સોનુ, ચાંદી ત્યા બીજુ દુન્યાવી ચીજવસ્તુની માંગણી કરી શકે. તે સમયે રસૂલ (સ.અ.વ) પોતાના સાથીદારો સાથે બેઠા-બેઠા વાતો કરી રહ્યા હતા. આ જંગલી અરબે રસૂલ (સ.અ.વ) પાસે પોતાની હાજત રજૂ કરી દીધી અને આપણી પાસે સહાયતા માંગી. રસૂલ (સ.અ.વ) તેને થોડું આપ્યું પરંતુ તેને સંતોષ ન થયો.

તે માણસ મોટી ઉમ્મીદો લઈને આત્મ્યો હતો, તેની સરખામણીમાં રસૂલ (સ.અ.વ)એ આપેલું દાન તેને ખુબ ઓછું લાગ્યુ. આ કારણે તેણે ખરાબ મિત્રાનુલ હિકમત - 79

શર્જોથી રક્ષાલ (સ.અ.વ)નું અપમાન કરી નાખ્યું. આ જોઈને રક્ષાલ (સ.અ.વ)ના સાથી અને મિત્રો ખુબ જ ગુર્ક્ષે થઇ ગયા અને તે વ્યક્તિને સખત સજ કરવા માટે તેમનું ખુંબ ઉકળી ગયું પરંતુ રક્ષાલ (સ.અ.વ) એ પોતાના સાથીદારોને અટકાવી દીધા.

ત્યાર પછી રક્ષાલ (સ.અ.વ)ને જંગલી અરબને પોતાની સાથે પોતાના ઘરે લઈ ગયા અને જે શક્ય બન્યુ તેટલી વધુ સહાયતા કરી. જ્યારે તે જંગલી અરબે પોતાની આંખે જેણું કે રક્ષાલ (સ.અ.વ)ની સ્થિતિ બીજ રાજાઓ અધિકારીઓ જેવી ન હતી, અને તેણે જે સોનું અને ચાંદીની માંગણી કરી હતી, તે રક્ષાલ (સ.અ.વ) પાસે ન હતુ. તેથી હવે તેને સંતોષ થઇ ગયો કે તેમણે જે કાંઈ આપ્યું તે બરાબર છે. પછી તેણે આપ (સ.અ.વ)નો આભાર માનતા કહ્યું આપે મને જે કાંઈ આપ્યુ તેનાથી હુ સંપૂર્ણ સંતોષી છું. કાલે તે ખરાબ અને ગંદા શર્જો મારા માટે બોલીને મારા

સાથીદારો અને મિત્રોની લાગણીને દુઃખ પહોચાડ્યુ છે. તે લોકો તારાથી ખૂબજ નારાજ છે, અને મને એ વાતનો ડર છે કે તે લોકો તને કાંઈ જુકશાન પહોચાડે નહીં. અગર જે શક્ય હોય તો તું તારી લાગણી અને સંતોષની ભાવના તે લોકો સામે જહેર કરી હે, જેથી તેઓનો ગુરુસ્સો દૂર થઇ જય અને તને કાંઈ જુકશાન ન પહોચાડે. આ વાત પર તે જંગલી અરબે કહ્યું કે મને આમાં કાંઈ તકલીફ નથી. જીજે દિવસે તે જંગલી અરબ મદીનાની મર્ઝાધમાં આવ્યો, રોજની જેમ રસુલ (સ.અ.વ) તેમના સાથીદારો અને મિત્રો સાથે બેઠા હતા.

રસુલ (સ.અ.વ) એ પોતાના સાથીદારોને સંબોધન કરતા કહ્યું, ભાઈઓ આ માણસ મારાથી રાજ થઇ ગયો અને હવે તેને મારાથી કોઈ ફરીયાદ નથી પછી આપ (સ.અ.વ) એ તે અરબને સંબોધીને કહ્યું શું ભાઈ તુ મારાથી સંપૂર્ણ સંતુર્ણ (ખુશ) છે ને? તે માણસે નમ્રતા

પૂર્વક તે વાક્યો તે લોકો સામે કહ્યા જે રસૂલ (સ.અ.વ)ને એકાંતમાં કહ્યા હતા. તેની વાત સાંભળીને રસૂલ (સ.અ.વ)ના સાથી અને મિત્રો હસવા લાગ્યા.

તે સમયે રસૂલ (સ.અ.વ) તે લોકોને સંબોધન કરતા કહ્યું, આ પ્રકારના લોકો અને મારુ દ્રષ્ટાંત ઓપું છે કે જે માણસનું ઉટ કોઈ વાતમાં તેના માલિકથી રિસાયને જુંગાલ તરફ ભાગવા લાગ્યુ હોય. તેનો માલિક ઉટની પાછળ દોડતો હોય અને આ જોઈને તે માલિકની સહાયતા માટે બીજા લોકો ભેગા થઈને ખુબ જેરજેરથી અવાજ કરવા માંડે અને એક ટોળુ તે શીસાયેલા ઉટને પકડવા પાછળ દોડવા લાગ્યુ ટોળુ પાછળ દોડતા ઉટે તે જોઈને ખુબ ઝડપથી ભાગવા લાગ્યુ. આ જોઈને ઉટનો માલિક ગલ્ભરાઈ ગયો અને મોટા અવાજ બોલ્યો બાઇઓ તમને વિનંતી છે, કે તમે મારા ઉટ પાછળ ન દોડો. મારા ઉટને કેમ મનાવવું તે હું સારી રીતે જણું છું. તેની આ વાત સાંભળીને ઉટ પાછળ

છોડતુ લોકોનું ટોળુ અટકી ગયું ત્યાર પછી ઉટનો માલિક પોતાના હાથમાં થોડો ચારો લઈને ધીમે ધીમે તેની પાસે પહોંચી ગયો અને ખુબજ સરળતાથી પોતાના હાથમાં ઉટની લગામ લઈ લીધી અને ખિજાય ગયેલું ઉટ તેના માલિક સાથે પાછુ આવી ગયુ.

અગર મે તમને કાલે રોક્યા ન હોત તો કમનસીબ અરબને પોતાનો જીવ ગુમાવવો પડત અને તમે લોકો એને જીવતો ન છોડત અને તે કુદ્દ અને મુર્તિ પૂજણી હાલતમાં મૃત્યુ પામત. આ વાતને દ્યાનમાં રાખીને મે તમને અટકાવી દીઘા અને તમે જોયું કે જો તે ત્યક્તિને પ્રેમ અને નરમાશથી મે બિલકુલ મુત્મદ્ધન કરી દીઘો.

કણલુલ બસર પેજ:૭૦ (સર્વી કહાનીયા બા.૧ પેજ.૩૨થી૩૪)

પ્રકરણ – ૨૧ ગુરુસો નઈં કરતો!

ઓકવાર ઓક જંગલી અરબ મદીના આત્યો અને રસુલ (સ.અ.વ) થી વિનંતી કરી કે તેઓ મિઝાનુલ હિકમત - 83

તેને ઉપદેશ (જસીહત) આપે. આપ (સ.અ.વ)એ તે વ્યક્તિને સંબોધન કરતા કહ્યું “ગુરુસો કરશો નઈં” આ વાક્ય સિવાય રસૂલ (સ.અ.વ)એ બીજુ કશું ન કહ્યુ.

ત્યાર પછી આ માણસ પોતાના કબીલા (ગુપ) તરફ પાછો ચાલ્યો ગયો. પોતે ઘરે પછોંચ્યો કે તુર્ણત ૪ તેને ખબર પડી કે તેને ગેરહાજરીમાં એક ઘટના બની ગઇ. તેની જતિના (જમાતના) કેટલાક યુવાનોએ બીજા કબીલા(જમાત)નો કેટલોક માલ જબરજસ્તી કરીને લુટી લીધો. અંદરો અંદરની લુંટ્ફાટનો મામલો ત્યાં સુધી પછોંચી ગયો હતો કે બંને કબીલાઓ વચ્ચે યુદ્ધની તૈયારી થઈ ચુકી હતી. આ સમાચાર સાંભળતા ૪ તે વ્યક્તિ કોધ(ગુરુસા)થી લાલચોળ થઈ ગયો. તુર્ણત ૪ પોતાના શર્ઝો તૈયાર કર્યા અને યુદ્ધના મેદાનમાં પોતાના કબીલાના માણસોને મદદ કરવા પછોંચી ગયો.

રસ્તામાં જ તેને વિચાર આવ્યો કે હમણાં જ હું મદીના ગયો હતો અને રસ્તુલ (સ.અ.વ) થી ઉપદેશ (નસીહત) લીધો હતો કે ગુરુસા પર કાબુ રાખવો. પછી તે વિચારવા લાગ્યો કે એવી કઈ વરતુ છે, જેણે મને શરૂઆતમાં ઉઠાવવા માટે મજબુર કરી દીધો? અને એવું કયું કારણ છે, જેને કારણે હું લડવા માટે મરવા અને મારવા માટે લોહી વણાવવા માટે તૈયાર થઈ ગયો? આખરે હું આટલો બધો ગુરુસે શા માટે થઈ રહ્યો છુ? પોતાના મનમાં આ પ્રશ્નો કર્યા બાદ તેણે વિચાર્યુ કે આ સૌથી વધુ યોગ્ય સમય છે કે જ્યાં મારે રસ્તુલ (સ.અ.વ) ની નસીહત (ગુરુસો ન કરો તેના) પર અમલ કરવો જોઈએ.

તે પોતાના કબીલાના લશકરમાંથી બહાર આવ્યા અને સામેના કબીલાના સરદારને બોલાવ્યો. જ્યારે તે કબીલાનો સરદાર નજીદ આવ્યો ત્યારે તેણે પૂછયું આખરે વાત શું છે કે આપણે એક જીજાના ખુનના તરસ્યા થઈ ગયા

છીએ? અગર આ લડાઈનો હેતુ તે માલ પાછો મેળવવાનો છે, જે માલ અમારા કબીલાના યુવાનોએ મુખ્યાંથી તમારા કબીલાના લોકો પાસે થી જબરજસ્તી છીનવી લીધો છે, તો આવો આ માલની હિમત હુ મારા માલ માં થી આપી દઉ. આ એવી કોઈ મોટી વાત નથી જેના કારણે આપણે એક બીજાના ખુનના તરફચા થઈ જઈએ. જ્યારે બીજ કબીલાના લોકોએ તે માણસની બુધિ પુર્વકની વાત સાંભળી તો તેની નૈતિક હિંમત અને મર્દાનગી જગી ગઈ અને તેઓ બોલ્યા અમે પણ તારાથી જરાય નીચા નથી. અગર આ જ વાત છે તો અમે અમારો દાવો પાછો ખેંચી લઈએ છીએ ત્યાર પણી બંને કબીલાના લોકો હસ્તી ખુશી પોતાના ઘરે પાછા ફર્યા .

ઉસુલે કાણી ભાગ-૨ પે.૪૦૪ (સર્વી કહાનીયા ભાગ : ૧ પેજ.૩૭-૩૮)

પ્રકરણ – ૨૨ તે ઈસાઈ મુસ્લિમાન થઈ ગયો.

હ.અલી (અ.સ.)ના શાસનકાળ દરમિયાન તેમની ઠાલ કુફ્ફામાં ખોવાય ગઈ. થોડા દિવસો પછી તે ઠાલ એક ઈસાઈની પાસે જોવા મળી. અલી અ.સ.એ તે ઈસાઈને લઈને જ્યાયધીશના દરબારમાં પહોંચ્યા અને તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કે આ ઠાલ મારી સંપત્તિ છે. આ ઠાલને મેળ તો કોઈને વેચી છે. અને ન તો કોઈને ભેટમાં આપી છે. ઘણા લાબા સમય બાદ મારી આ ઠાલ આ વ્યક્તિ પાસે જોવા મળી છે. જ્યાયધીશે ઈસાઈને સંબોધીને કહ્યું ઠાલના સંબંધમાં બાદશાહે પોતાની ફરિયાદ દાખલ કરી છે. આ બાબત માં તારે શું કહેવું છે? તેણે જવાબ આપ્યો, આ ઠાલ મારી વ્યક્તિગત માલીકીની છે, સાથે હું તેમ પણ કહું છું કે બાદશાહ પણ ખોટું બોલતા નથી (શક્ય છે કે તેમને (ઠાલ) ઓળખવામાં બુલ થઈ હોય).

ન્યાયધીશો અલી (અ.સ.)ને સંબોધન કરતા કહ્યું, તમે દાવો કરનાર છો પરંતુ આ માણસ તેનો ધનકાર કરે છે, તેથી હવે આપની ફરજ બને છે કે તમે તમારા દાવાને સાખિત કરવા મારે કોઈ સાક્ષી રજુ કરો.

હ.અલી (અ.સ.) હસતા હસતા બોલ્યા ન્યાયધીશ સાહેબ બરાબર કહે છે. મારે સાક્ષી રજુ કરવા જોઈએ, પરંતુ સંજોગોવશાત મારી પાસે કોઈ સાક્ષી નથી.

સાક્ષી ન હોવાને કારણે ન્યાયધીશો તે ઈસાઈની તરફેણમાં ચુકાઓ (ફેસલો) આપ્યો. ન્યાયધીશનો હુકમ સાંભળતાજ તે ઈસાઈએ ઠાલ પોતાના હાથમાં લીધી અને પોતાના ઘર તરફ ચાલતો થયો. પછી થોડે સુધી ચાલ્યા પછી તેની રિચિત્રિ ખૂબજ વિચિત્ર થઈ કારણે તે જણતો હતો કે આ ઠાલ અલી (અ.સ.)ની છે અને તે પાછો કર્યા અને કહેવા લાગ્યો.આ શાસન પદ્ધતિ અને લોકો સાથેનો વ્યહાર સામાન્ય માનવીના

વ્યાઘાર જેવો લાગતો નથી આ શાસન પદ્ધતિ નબીઓની શાસન પદ્ધતિ જેવી છે. ત્યાર પછી તે વ્યક્તિએ સ્વીકારી લીધુ કે ખરેખર આ ટાલ હ. અલી (અ.સ.)ની છે. થોડા દિવસ બાદ લોકોએ જોયુ કે તે ઈસાઇ મુસલમાન બની ગયો અને ખુબજ લાગણી સાથે તેણે હ. અલી (અ.સ.) ના અલમ નીચે નહુવાનના ચુંધમાં પણ ભાગ લીધો.

(અલ ઈમામ અલી સૌતલ અદાલતુલ ઈન્સાનીયા પેજ.૫૩) (સર્વી કહાનીયા ભાગ:-૧ પેજ.૩૮-૪૦)

પ્રકરણ – ૨૨ ફોઝેલનો બેઈમાન વિદ્યાર્થી

મશાહુર અને પ્રસિદ્ધ તાઅ૰ેબ ફોઝેલ અચાઙનો એક વિદ્યાર્થી હતો. જે હોશીયાર બુદ્ધિશાળી હતો, તે એક વખત બિમાર થયો અને તે મૃત્યુની નજીદી હતો. ફોઝેલ અને બીજ લોકો તેની ખબર અંતર પૂછવા માટે તેના ઘરે ગયા. ફોઝેલે સુરે યાસીન પઠવાનું શરૂ કર્યુ તો એ મિઝાનુલ હિકમત - 89

બદબખ્તે ઉસ્તાદના હાથ પર હાથ મારીને કહ્યું, કે હું નથી ચાહતો કે કુર્અન પઠો. આ એજ બદનસીબ છે કે હંમેશા મર્જીએ મદ્રેસા અને ઈબાદતમાં હાજરી આપતો હતો અને એહલેકુર્અન હતો, પરંતુ અત્યારે તે કહી રહ્યો હતો કે હું નથી ચાહતો કે કુર્અન પડો. મૃત્યુના સમય નજીદીક આવી રહ્યો હતો. ફોઝેલ કલમે શહાદતૈન (લાઅલાહ ઈલ્હલાહ) પડાવવા ચાહ્યું પણ તેણે તેની જબાન પર કલમો પણ ન પડયો અને આ જ હાલતમાં તે મૃત્યુ પામ્યો.

ફોઝેલ આ બનાવ પછી ખુબ જ ગમગીનને દુઃખી થયા અને તેઓ એકલવાયુ જીવન પસાર કરવા લાગ્યા. કોઈની સાથે મુલાકાત (વાત ચીત) પણ કરતા ન હતા. અને ઘરની બહાર નીકળતા નહીં. પછી એક વખત તે વિદ્યાર્થીની ખરાબ (અજાબમાં ગિરફ્તાર) ઝણ તેમના સ્વપનમાં આવી.

ફોઝેલ તેને આખેરતના અઝાબ વિશે પૂછ્યું.
તેણે કહ્યું કે મારામાં ત્રણ વસ્તુ એવી હતી કે જેને
કારણે હું દુનિયામાંથી બેઇમાન (કાફીર)ની
હાલતમાં મૃત્યુ પામ્યો (૧) હસદ (ઈધા,
અદેખાઈ)ને કારણે હુ કોઈને મારાથી સારી
હાલતમાં જોઈ શકતો ન હતો. (૨) ચાડી અને
ચુગલખોરી જેને કારણે હુ બે વ્યક્તિઓ વચ્ચે
જુદાઈ કરાવી દેતો અને (૩) શરાબખોરી (ચચ્ચે
વાકેઆત પેજ.૫)

પ્રકરણ - ૨૪ નમાઝ શબ

(૧) નમાઝ શબ પડવાના ફાયદા

પચાંમબરે ઈસ્લામ (સ.અ.વ.) હજરત
અલી (અ.સ.)ને વસીયત તરીકે ત્રણ વખત
ફરમાવ્યું કે ‘અલયક બિર્સલાતુલ્લાલ’ નમાઝે
શબ અદા કરો.

હજરત ફરમાવ્યું કે નમાઝ શબ પડવાથી
નીચેના લાભ મળશે.

ખુદા રાજી થાય છે. મલાઅદો દોષ્ત રાખે છે. અંબિયાની સુક્ષ્મત છે. માઅરેફતનું જુર છે. ઈમાનનું મુળ છે. શરીરનું સુખ છે. શયતાન તેનાથી દુર રહે છે. દુશ્મનો તેના ઉપર હુમલો નથી કરી શકતા. દોઆ અને આમાલ કબુલ થાય છે. રોકીમાં બરકત થાય છે. મલેકુલ મૌત પાસે શક્તાઅત કરે છે. કબ્રમાં રોશની થાય છે. કબ્રમાં બીજીસર બને છે. મુંડર અને નકીરને જવાબ આપવામાં મદદ કરે છે. કબ્રમાં સાથી બને છે. કયામતના દિવસે છાંયો કરશો. તાજ બનશો. પોધાડ બનશો. રોશની બનશો. જહિયામ વર્ચ્યે આડો પર્દો બનશો. ખુદા પાસે માઝી મેળવવાનું કારણ બનશો. નેક કાર્યોના મીઝાનને ભારી કરશો. પુલે સેરાત ઉપરથી પસાર થવામાં આસાની થશો. બેહિશ્તની ચાવી છે.

(૨) નમાજે શબ પડવાનો વખત

અધી રાતથી લઈ તુલુએ સુજણ સાંદિક સુધી છે. (સુજણની નમાજના વખતથી નજીદીક સુધી મિઝાનુલ હિકમત - 92

પડી શકાય છે.) જેમ સુજણી નમાજના વખતની નજીદીક પડે તેમ અફ્રજલ છે.

(૩) નમાઝ શબ પડવાની સહેલી મુખ્તસર રીત આ મુજબ છે. નમાઝ શબ કુલ ૧૧ (અગ્રીયાર) રકાત છે (જે નીચે મુજબ બતાવેલ છે.)

૧. (આઠ) એ રકાત નમાજ બજ્જે રકાત કરીને નમાઝ શબની નિર્યતથી પડે.

૨. બે રકાત નમાઝ શાફ્શાઅની નિર્યત કરી પડે.
(જેમાં કુન્જુત પડવાનુંનથી)

૩. નમાઝ વિત્ર ઓક રકાત નીચે મુજબ પડે.

ઓક વખત અલછમદનો સુરો પડે.

ત્રણ વખત કુલ્હો વધાહો અછદ નો સુરો પડે.

ત્રણ વખત કુલ અઉઝો બે રજીલ ફ્લકનો સુરો પડે ઓક વખત સુ.નાસ પઢે પછી કુન્જુતમાં ઈસ્તીજ્ઞાર કરે, દુઆ પઢે.